

વિંગ

પક્ષીનિરીક્ષકો વર્ષોનો સેતુ

ગ્રીબ્લ ૨૦૦૩



કાળિયા કોથીનો માળો, વીજળીના તાર ૭૫૨ (જુઓ નિરીક્ષક નોંધ પાનું ૧૦)

પચામ્શક : લાલબંસિંહ રાઓલ

સંપાદક : ડૉ. બહુલ નિવેદી

થોડીક પ્રકૃતી વાતો

વાતસિંહ રાઓલ



“હિંગોળગઢમાં બપૈયો દમેશથી છે”, એ કિર્ષક નીચે ગયા અંકના પૃ. ૨૨ ઉપર શ્રી ઉદ્ય વોરાનો પત્ર છે. શ્રી લવકુમાર ખાચર હિંગોળગઢમાં જ ઉછ્યા છે, એમ કઢી શકાય. આથી તાંનાં પંખીઓનો તેમને ઘનિષ્ઠ અનુભવ હોય તે દેખીતું છે. તેઓ લખે છે કે, “પહેલાના સમયમાં બપૈયો ક્યારેય સાંભળવા મળતો નહીં.” તેનો અર્થ શું, તે સમજી લેવું જરૂરી છે.

સલીમ અલીની ‘The Book of Indian Birds’ પહેલા ‘ઈલસ્ટ્રેટેડ વીક્લી’માં હા વાર છપાતી. પુસ્તક સ્વરૂપે તે ૧૯૪૧ના ઓગસ્ટ માસમાં પ્રસિદ્ધ થઈ. સ્વ. શ્રી શિવરાજકુમાર અને લવકુમાર તે પહેલાંથી પક્ષીઓમાં રસ લેતા થએલા, આથી ‘વીક્લી’માં આવતી લેખમાળા તેઓ બને રસથી વાંચતા. આમ તેઓએ ૮-૧૦ વરસની ઉમરથી પક્ષીનિરીક્ષણ શરૂ કરેલું.

શ્રી લવકુમાર ખાચરના આગ્રહ અને માર્ગદર્શનથી અમે થોડા મિત્રોએ ૧૯૭૫થી હિંગોળગઢમાં પ્રકૃતિ પરિચય શિબિરો શરૂ કર્યા. ૧૯૭૮ સિવાય આજ ટિન સુધી, દર થોમાસે તે થતા રહ્યા છે. સને ૧૯૭૫, '૭૬, '૭૭, '૭૮નાં વરસોમાં અમને બપૈયો, ત્યાં સાંભળવા કે જોવા મળેલ નહીં. ૧૯૭૮માં મોરબીનો મય્યું બંધ તૂટવાથી થએલ હોનારંતને હિસાબે અમારે હિંગોળગઢ શિબિર રદ કરવો પડેલો. ફરી ૧૯૮૦માં ચાલુ કર્યો. કદાચ ૧૯૮૦માં અમને પહેલી વાર ત્યાં બપૈયો સંભળાયો. બીજા વરસે તેની ગ્રાં જોડી ત્યાં મને જોવા મળી. શ્રી લવકુમાર ખાચરે જ્ઞાનવેલ “પહેલાનાં વરસો” એટલે શું, તે હવે સમજશે.

શ્રી લવકુમાર ખાચર પોતાના '૬૦-'૬૨ વરસનાં પક્ષી

નિરીક્ષણોના અનુભવ ‘વિહુંગાવલોકન’માં નિયમિત લખતા રહે છે. તે જ પ્રમાણે, તેમના જેવા જ આપણા બીજા વરિજ પક્ષીવિદ્ય શ્રી હિમતસિંહજી પણ પોતાના અનુભવો ‘વિહુંગા’માં આવ્યા કરે છે. પક્ષીનિરીક્ષણમાં પા પા પગલી માંડનારાઓ પોતે જોયેલ પંખીઓની યાદી લાંબી થતી રહે તે માટે બહુ આતુર હોય છે. આમાંના મોટા ભાગના, આપણાં ચકલી, કાગડા, કબૂતર, કબર જેવાં સામાન્ય પંખીઓ પ્રત્યે દુર્લભ કરતા હોય છે. પણ આવા સામાન્ય પંખીઓની જીવનયર્થ વિશે આપણે જુદી ઘણું બધું જાણવા-જોવાનું બાકી છે. વરસો પહેલાના સ્વ. સલીમ અલીની એક નોંધ ‘Newsletter for Birdwatchers’માં પ્રસિદ્ધ થએલી. આપણી ચિરપરિચિત ચકલી બાબતમાં વધારે નિરીક્ષણ અન્વેષણ કરવા માટેના પંડરેક મુદ્દ તેમાં આપેલા ! હવે જો ચકલી (Common House Sparrow)-ની બાબતમાં આ પરિચયિત હોય તો બીજા પંખીઓની ક્યાં વાત કરવી? શ્રી હિમતસિંહજીએ ગયા અંકમાં આ બાબત તરફ આપણા સૌનું ઘણ દોર્યું છે, તે ખૂલવા જેવું નથી.

આપણા પોપટ અને કબૂતરને હું સંપૂર્ણ શાકાહારી પંખીઓ માનતો. સ્વ. ધર્મકુમારસિંહજીએ એક વાર કહેલું કે, “I have seen pigeons eating termites”, તે મને યાદ છે. શ્રી હિમતસિંહજીએ પણ ગયા અંકમાં આ બાબતનું પોતાનું નિરીક્ષણ આપ્યું છે. આમ સંપૂર્ણ શાકાહારી પંખીઓમાં હવે ફક્ત આપણા પોપટ રહે છે.

સી-૨, હરિઓમ એપાર્ટ, ગાઈસ ઓફ ઇન્ડિયા ‘પ્રેસ રોડ, જવરાજ પાર્ક, અમદાવાદ-૫૧

કાલાક કલીલાક

૧૦૦૦-૦૦ રાજુભાઈ દેસાઈ, નવસારી	૧૦૦-૦૦ ડે. એસ. કે. મહેતા, ભાવનગર	૧૦૦-૦૦ સુરેશ નાકરાણી, કુંકાવાપ
૧૦૦૦-૦૦ પ્રશાંત મહેતા, વાપી	૧૦૦-૦૦ આશ્રિ શુક્રલ, ભાવનગર	૧૦૦-૦૦ ડે. અમિત કક્ષર, મહુવા
૫૦૦-૦૦ અશોકભાઈ પટેલ, નવસારી	૧૦૦-૦૦ ભરત મેનેયે, ભાવનગર	૧૦૦-૦૦ જયપાલસિંહ જહેજ, જમનગર
૫૦૦-૦૦ રાજેન્દ્ર શાહ, અમદાવાદ	૧૦૦-૦૦ દુર્ઘાતસિંહ ગાલા, ભાવનગર	૧૦૦-૦૦ અજતું ભણી, ધરી
૫૦૦-૦૦ રમેશભાઈ દવે, અમદાવાદ	૧૦૦-૦૦ પંચાલય, પારેન કલેજ, મહુવા	૧૦૦-૦૦ શાતિલાલ વડુ, ભુજ
૫૦૧-૦૦ પંચેશ છાપા, ચિકાગો, યુ. એસ. એ.,	૧૦૦-૦૦ એન. એન. દવે, કોરોં	૧૦૦-૦૦ કે. ડી. ચૌહાણ, ભુજ
૩૦૦-૦૦ ડે. ભવબુતી પારાશર્ય, આંદાં	૧૦૦-૦૦ સેહલ પટેલ, આંદાં	૧૦૦-૦૦ અચિન પોમલ, ભુજ
૨૫૦-૦૦ જે. એસ. સોંકીંદી, ભુજ	૧૦૦-૦૦ ગારેન પંચાલ, જમનગર	૧૦૦-૦૦ માઈ. માઈ. દરવાટિયા, ભુજ
૨૫૦-૦૦ યોગેન શાહ, સુરેન્દ્રનગર	૧૦૦-૦૦ જગદીશભાઈ મોરજરિયા, આંદાં	૧૦૦-૦૦ એમ. બી. ખની, ભુજ
૨૫૦-૦૦ ડે. એમ. વી. વચ્છરાજાની, અમદાવાદ	૧૦૦-૦૦ ડે. એન. રંક, આંદાં	૧૦૦-૦૦ સુભેદ ધાથી, ભુજ
૨૦૦-૦૦ ડે. નિયતી મળિયાર, અમદાવાદ	૧૦૦-૦૦ સતીશ મિસ્ટ્રી, આંદાં	૧૦૦-૦૦ નિલોચન છાપા, ભુજ
૨૦૦-૦૦ એમ. આર. ગોરાતેલા, ગાંધીનગર	૧૦૦-૦૦ જય પટેલ, ભુજ	૧૦૦-૦૦ ડે. એસ. સી. વારિજ, આંદાં
૧૦૦-૦૦ ડે. રાજીવ ઢાકર, અમદાવાદ	૧૦૦-૦૦ સતીશ મિસ્ટ્રી, આંદાં	૧૦૦-૦૦ શ્રી. વેણીલાલ કલ્યાણી વિદ્યાલય, જસદાં
૧૦૦-૦૦ વિપીનભાઈ વેદ, ભાવનગર	૧૦૦-૦૦ દિગંબર ગાડગીલ, નાસિક	૧૦૦-૦૦ કાર્તિક શાસ્ત્રી, અમદાવાદ
૧૦૦-૦૦ ઈન્જ ગઢવી, ભાવનગર	૧૦૦-૦૦ દીપક ગજજાટ, રાજીકોટ	૧૦૦-૦૦ ગોવિદભાઈ વેંકરિયા, કોરોં
૧૦૦-૦૦ ડે. બિપન્નાઈ પટેલ, ભાવનગર	૧૦૦-૦૦ ભરત પટેલ, મુ. વાપ, જિ. સુરત	૫૦-૦૦ શયમજભાઈ જોડે, ભાવનગર

સૂચિ

થોડા પ્રલીંગ વાતો	૨
વિહંગાવલોધન	૪
નિર્વિક્ષણ નોંધ	
- આજુ-રની માળા - સૃષ્ટિ	૮
- કાળાકોશીનો માળો, વીજળીના તાર ઉપર	૧૦
- પકીઓની અસામાન્ય ચાંચ	૧૦
- મત્સ્યભોજ બતક, વડોદરા પાસે	૧૫
ગાંધી પર જાપતો	૨૩
સારકાર વોચ	૨૪



પકીઓની કાળા વિભિન્ન-પોરબંદર ૨૫

આવકણ

કાળાકોશીનો માળો,
વીજળીના તાર ઉપર

તસવીર : ભૂખણ પેંડ્યા, રાજકોટ

કંપાદકીય



“નળસરોવરમાં પાણી નથી.” આ વખતે ચર્ચાનો આ એક અગ્રિમ મુહે બની રહ્યો. જુદી જુદી ચર્ચાસભાઓમાં સૌ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા.

સામાન્ય રીતે નળસરોવર લગભગ દર વર્ષ જૂન મહિના સુધીમાં સુકાઈ જતું હોય છે. આ તેની આગવી ખાસિયત છે. દુષ્કાળનાં વર્ષોમાં તેનું વહેલું સુકાઈ જવું, એ પણ અસાધારણ ઘટના નથી. ૮૦ના દાયકામાં જ્યારે ગ્રાન્ડ વર્ષ સતત દુષ્કાળ રહ્યો હતો, ત્યારે પણ નળસરોવર આ રીતે જ સુકાઈ ગયું હતું.

દરેક જળપ્લાવિત ક્ષેત્રની પોતાની વિશિષ્ટ પ્રકૃતિ હોય છે. આ વિશિષ્ટતા સદીઓથી સચ્ચાયેલી હોય છે, કોઈ એક કુદરતી ઢાંચામાં વિકસેલી હોય છે. આ દરમિયાન સઞ્ચચ સૃષ્ટિ સાથે તેનું તાદાત્મ્ય સધાયેલું હોય છે. તે જળપ્લાવિત ક્ષેત્રની લાક્ષણીકતાઓને સાનુકૂળ થઈને જૈવિક સૃષ્ટિએ ત્યાં પોતાનું સ્થાન જમાવ્યું હોય છે. આમ દરેક કુદરતી જળપ્લાવિત ક્ષેત્ર એ પ્રકૃતિનું અનોખું સર્જન છે. આપણી ફરજ એ જોવાની છે કે, તેનું વૈશિષ્ટ્ય જળવાઈ રહે. આપણા બધા પ્રયત્નો તેના રક્ષણ માટે હોવા જોઈએ. શું તેના જળમાં વિસ્તાર (catchment area) માં કોઈ અવરોધ તો નથી ને? શું તેમાં એકત્ર થતું પાણી કર્યાં પ્રદૂષિત તો થતું નથી ને? ત્યાંનું પાણી વપરાશ માટે અધિક માત્રામાં નથી લેવાતું ને? ગેરકાયદેસર રીતે માણીમારીની તે શિકારની પ્રવૃત્તિ તો નથી થતી ને?



વિહંગ

વર્ષ-૨ સાલંગ અંક ૧૮ ચીજું ૨૦૦૩

પરામર્શક

લાલસિંહ રાઓલ ડૉ. બનુલ નિવેદી

સંપાદક મંડળ

પા.એસ.ટક્કર, ડૉ.આર.બી.બલર, કે.ડી.વૈષણવ

પત્રચ્યવલાર

૧૬/૪૧૪, સત્યાગ્રહ છાપણી, સેટેલાઈટ રોડ,
અમદાવાદ-૩૮૦૦૧૫

E mail : vihangujarat@yahoo.co.in

સ્વૈચ્છિક લાવાજમ : વાર્ષિક રૂ. ૧૦૦-૦૦

(શુભેચ્છા કાળો આવકાર્ય -

‘વિહંગ’ ના નામે ચેક / પ્રાઇવ્ટ અથવા મ. ઓ.થી.)

પ્રકાશક : લાલસિંહ રાઓલ, સી-૨, હરિઓમ
એપાર્ટમેન્ટ, રાઈસ ઓફ ઇન્ડિયા પ્રેસ રોડ,
જીવરાજ પાર્ક, અમદાવાદ-૩૮૦૦૫૧.

મુદ્રક : ડૉ. બનુલ નિવેદી, મુદ્રણસ્થાન : ‘શારદ
પ્રકાશન’, ૫, સનપોઈન્ટ કોમ્પ્લેક્સ, ગુરુકુણ ટાવર સામે,
અમદાવાદ-૩૮૦૦૫૨.

જળપ્લાવિત ક્ષેત્ર કે તેના ઉપર નિર્ભર સઞ્ચચ સૃષ્ટિને લગતા પ્રશ્નો માટે મહદૂસ અંશે આપણી વધતી જતી વસ્તી તથા તેની સાથે સંકળાયેલી સામાજિક તથા આર્થિક સમસ્યાઓ જવાબદાર છે. જળપ્લાવિત ક્ષેત્રના અસ્તિત્વ માટે જે કુદરતી પરિબળો કામ કરે છે, તેને આપણે સમજવા જોઈએ, સ્વીકારવા જોઈએ. નેસર્જિક પ્રશ્નોને ઉકેલવા પ્રકૃતિ પોતાની રીતે જ સંક્ષમ હોય છે, આપણી દંખલગીરીમાં જોખમ રહેલું હોય છે. હું એક એવો શિરસ્તો થઈ ગયો છે, ખાસ કરીને પ્રસાર માધ્યમોને લીધે કે, કોઈ પણ વધારણાનું સનસનાટીભૂય નિરૂપણ કરવું. પર્યાવરણને લગતા મુદ્દાઓ - સવાલોને વૈજ્ઞાનિક દાટિકોણથી સમજાને પછી જ તેના વિષે કોઈ અભિપ્રાય બંધાવો જોઈએ. આપણે સૌંઘે પણ જવાબદાર નાગરિક તરીકે, પર્યાવરણીય મુદ્દાઓને ‘છાપે ચડાવતાં’ પહેલા તેના અંગે પૂરી જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ.

થોળના પણ્ઠો કૃત્રિમ છે અને તેને માટે ખરેખર કોઈ તાત્કાલિક નિવારણની જરૂર છે. સામાન્ય રીતે, સિચાઈ માટે બનાવેલા આ તળાવમાંથી, વધુ પડતું પાણી સિચાઈ માટે ઉપયોગમાં લઈ લેવાનો પ્રશ્ન રહેતો હતો. આ વર્ષે નર્મદાનું પાણી તેમાં ઠલવાતાં તે છલકાઈ ગયું છે. જેમ પાણીની ગેરહાજરી પક્ષીઓ માટે વિષમ પરિસ્થિતિ સર્જે તેમ વધુ પડતું પાણી પણ કરી શકે - તેનો આ તાદશ દાખલો. કોઈ અગમ્ય રાજકીય કારણોસર સિચાઈ વિભાગ, તળાવની પાણીની સપાઠી કોઈ પણ હિસાબે ઓછી કરવા તૈયાર નથી. એક અભયારણ્યની આ દુર્દીશા! 'અભયારણ્ય'નો દરજો પણ કોઈ વિસ્તારને અભયદાન નથી આપી શકતો!

છેલ્લા ગાણ માસમાં બે સુંદર પર્યાવરણાલક્ષી કાર્યક્રમોમાં હાજર રહેવાની તક મળી. તા.૪-૧-૦૩ના રોજ થોળ નજીકના મુકામે એક મંદિરના માંગણામાં એ.સી.એફ. શ્રી શેતાંક પંડિત દ્વારા સ્થાનિક પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે એક શિબિરનું આયોજન થયું હતું. તેમાં તેઓએ શિક્ષક ભાઈબહેનોને થોળ અભયારણ્ય અંગે પ્રાથમિક માહિતી પૂરી પાડી અને તેની અગત્યતા સમજાવી. બપોર પછી તેઓને તપાવ કંડે જઈને પક્ષી-દર્શન કરાયું. આ પ્રયોગ મને ખૂબ ઉપયોગી

લાય્યો. નવી પેઢીને તૈયાર કરવાની જવાબદારી જેમના શિરે છે તેવા શિક્ષકોમાં, પર્યાવરણ-સંરક્ષણ અંગે જાગૃતિ કેળવાય તો નવી પેઢી સુધી પ્રાકૃતિક સંપત્તિની સુરક્ષાનો જે સંદેશો આપણે પહોંચાડવાનો છે, તે સહેલાઈથી પહોંચાડી શકાય. વળી, અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતાં બાળકોમાં એ સંરક્ષિત વિસ્તારના મહત્વ અંગે સમજા કેળવાય તો તેને લાંબા અરસાનું રોકાણ ગણી શકાય.

બીજી તરફ, તા. ૧૧-૧-૦૩ના રોજ ડી.સી.એફ. શ્રી ઉદય વોરાએ મોડાસા ખાતે, 'ફિરેસ્ટ ગર્ડ' માટે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું, જેમાં તેઓએ પક્ષીઓની ઓળખ, વન્ય પણુંઓનાં પગલાંની ઓળખ વળે અંગે માહિતી આપી હતી. તેઓએ ખૂબ મહેનતથી આ માટે શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી હતી. જેઓ જંગલના પ્રાથમિક રખેવાળ છે, તેઓમાં સજીવસૂચિ અંગે રસ જાગૃત થાય, તે અંગે તેમની જાણકારી વધે તો તેમની કાર્યક્રમતા પણ વધે.

તુંઝુંઓની અનિયમિતતાની જેમ 'વિહંગ'ના પ્રકાશનમાં પણ થોડી અનિયમિતતા આવી છે. દરગુજર કરશો! આવતા અંકોમાં અમે એ ગાળો પાછો મેળવી લઈશું.



વિહંગાવલોકન

કોઈ વિશિષ્ટ શોખ પાછળ ગાળેલ સમયને લીધે વાજ્ઞિને અદકેરો મોભો મળતો હોય એવું દેખાય છે. 'બોઝે નેચરલ હિસ્ટરી સોસાયટી' સો વરસથી વધારે જૂની સંસ્થા છે. તેના જે આજીવન સભ્યો પચાસ વરસથી ચાલુ હોય તેમને સન્માનવાનું તેણે નક્કી કર્યું. ગયા વરસે આવા ફક્ત ૧૪ સભ્યો હતા! હિમતસિહિલ અને હું, એમ અમે બંને આવા હ્યાત તથા સક્રિય સભ્યો છીએ, તે જાણી પ્રસત્ર થઈ જવાયું. સભ્યોને લખાતા પોતાના માસિક પત્રમાં સોસાયટીના માનદ મંત્રી શ્રી જે.સી.ઉનિયલે અમારા બંનેનો ગુજરાતના આખરી પક્ષીવિજાનીઓ તરીકે ઉત્થેખ કર્યો

લવકુમાર ખાયર
(અનુ: ડૉ. બનુલ નિવેદી)



છે. હસતાં હસતાં ઉનિયલની વાતમાં સુખારો સૂચ્યવતાં મેં કહ્યું કે, "જો અમે બંને તે જમાતના અવશેષો હોઈએ તો અમે ઉપખાસ અને દફકાને પાત્ર ગણાવા જોઈએ." ખરેખર તો ગુજરાતમાં એક લશ્કર જેટલા સારા પક્ષીનિરીક્ષકો છે, એવું કહીને મેં ઉમેર્યું કે, "આમાંથી ઘણા પ્રતિભાવાન પક્ષીવિજાનીઓ નીવડે તેવા છે." આજે તો સોસાયટીમાં અમે બંને ગુજરાતના અગ્રિમ પ્રતિનિષિ લેખાઈએ છીએ. પોતાની વિશ્વનીયતા ટકી રહે તે અંગે ખૂબ સાવધાન રહેવાનું યુવા પેઢીને આથી હું કલ્યા કર્યું છું.

હિંમતભાઈએ 'વિહંગ'ના ૨૦૦૨ના શરદ અંકમાં છેલ્લે પાને મારી આ ચેતવણીને પડધો પાડ્યો છે, તે જોઈ હું ખુશી થાઉં છું. તે જ અંકના સંપાદકીય લેખમાં શ્રી બહુલભાઈએ પણ એવી જ લાગણી વ્યક્ત કરી છે. આગળના અંકો ઉપર નજર ફેરવી જવાનો બધા મિત્રોને હું આગ્રહ કરું છું. આ બાબતને હળવાશથી લેવા સામે હું ચેતવણી આપતો રહું છું, તેની યોગ્યતા તેથી તેમને સમજાશે. ગુજરાતના આપણા બધાની સંપૂર્ણ વિશ્વસનીયતા જળવાઈ રહે, એ આપણી અગ્રિમ ચિંતા હોવી જોઈએ. આપણા પોતાના માટે તેમજ આ પ્રદેશનાં પંખીઓ માટે આટલું જરૂરી છે. મોટામાં મોટા પક્ષીસમૃદ્ધ વિસ્તારોમાંના એક તરીકે ગુજરાતની ગણના થાય છે, એટલું હંમેશાં યાદ રાખનો.

પક્ષીનિરીક્ષકોને પંખીઓ પ્રત્યે લાગકી છે. આપણી જમાત બળવાન બને અને અધિકતમ લોકો પંખીઓના યોગદ્ધેમની આપણી લાગણીઓને કાર્યાન્વિત કરવામાં સહભાગી બને, એવું કરવાની આપણી નૈતિક જવાબદારી છે. ગજાતંત્રમાં અને તેમાંથી 'નરમ રાજ્ય' તરીકે વ્યવહાર કરતા રાજ્યમાં રાજકર્તાઓ ઉપર જનમત એ પ્રબળ લગામ છે. ગુજરાતમાં વિશાળ બહુમતી આપણી તરફણેમાં છે. આ જ બાબતને લીધે આપણો પ્રદેશ અનન્ય રહ્યો છે. ગુજરાતના સૌથી ગીય વસ્તીવાળા પ્રદેશમાં મોર અને સારસ હજ આજે પણ ધ્યાન ખેંચાય એટલાં ટકી રહ્યા છે. ગુજરાતનાં જળાશયોમાં દેખાતાં મોટાં અને નાનાં હજ (Flamingo) કર્યાનાં બને રહ્યોમાં વિશાળ માળા વસાહતો કરી શકે છે. આ બાબતો બહુ સૂચક છે. આ પક્ષીઓ તેમજ ખડમોર (Likh), ગુજરાતનો અમૃત્ય ખજાનો છે, એ બાબતે મતભેદોને અવકાશ નથી. જીવમાત્રને પવિત્ર ગણવાની આપણી પુરાતન અને સુસંસ્કૃત પરંપરા સામે કોઈ શંકા ઉઠાવી શકે તેમ છે? દુનિયાભરમાં કદાચ ભુતાન અને બૌદ્ધધર્મી લડાખ સિવાય એવો પ્રદેશ તો બતાવો કે જ્યાં પ્રબળ લોકલાગણીને લાધે વન્યજીવો નિરાંતે હરીકરી શકતા હોય? ગુજરાત, રાજ્યસ્થાન અને હરિયાણા પણ આ હરોળમાં આવે. સક્રિય પક્ષીનિરીક્ષકો ધારે તો આપા ગુજરાતને એક ધબક્તું અભયારણ્ય બનાવી શકે. વિષિવત્ જાહેર કરાએલ અભયારણ્યો સંવેદનશીલ સંચાલનના નમૂના બનવા જોઈએ.

પોતાની દેખભાગ માટે સોપાએલ ખાસ ખાસ વિસ્તારના સંચાલન માટે વન્યજીવ વિભાગ ભલે સજીધજીને તૈયાર થાય, પણ બાકીના બધા પ્રદેશની કાગળ આપણે રાખવી જોઈએ. આપણો અરોશપરોશ પંખીઓને આકર્ષે તેવો બને તે માટે આપણે શક્ય તેટલા આગળ આવવું જોઈએ. જો ફળિયું હોય તો તેમાં અથવા રવેશમાં દરેકે પંખીઓ માટે દાણાપણી મૂકવાં જોઈએ. તિરાડો અને બખોલોમાં માળો કરનારાં ધાણાં બધાંપંખીઓને આકર્ષવા માટે આપણે બધા માળાપેટીઓ મૂકી શકીએ. સૌથી અગત્યની વાત તો એ છે કે, છોડ, વેલા અને વૃક્ષોની યોગ્ય જાતો આપણા ફળિયા તેમજ રસ્તાની બંને બાજુઓ વવાય તેની ચીવટ આપણે લેવી જોઈએ.

આ બધું તમે કરો એટલું જ નહીં પણ ન મારી આસપાસ થઈ રહેલા ફરફારોને ટપકાતી લેજો અને બીજા મિત્રો સાથે અનુભવોની આપલે કરજો. આમ જોરદાર પ્રજ્ઞામત ઊભો કરીને કાયદાનો અમલ કરનાર વ્યવસ્થાતંત્રના બાવડામાં આપણે બળ સીચી શકીએ.. સાથે સાથે અનેકો સાથે સંપર્ક વધારતા જઈએ. ખૂણે ખાંચરે પહોંચી ગયેલા ટેલિફોનનથી આવું સહેલાઈથી થાય. ડા.ત. કાસમ સમાચે બે ચાર અનુભવી પક્ષીનિરીક્ષકોને અથવા નન્સસરોવર અભયારણ્યના અવિકારીને ચેતપૂછ ટિટોરી (Whitetailed Lapwing)નું પ્રજનન જોવા આવવા ટેલિફોનનથી જણાવ્યું હોત તો પક્ષીવિજ્ઞાનમાં 'રેકોર્ડ' ગણાય તેવા એ બનાવની આપણે પુછ્યા કરી હોત. આપણા કેટલાય પંખી - તસવીરકારો તે અસાધારણ બનાવને, સૌ કોઈ માટે, કચકડામાં મઢી શક્યા હોત. કમનસીબે આવી પુછ્યા અભાવે કાસમ સમાના 'રેકોર્ડ' સામે મોટો પ્રશ્નાર્થ મૂકવો પડશે. તેમજે વનવિભાગના કર્મચારીઓનો સંપર્ક કેમ ન કર્યો? (તેમજે વનવિભાગના અવિકારીનો સંપર્ક કર્યો હતો અને તેની તસવીર શ્રી દેશણ પગીએ લીધી છે, તેવું મારી જાણમાં છે. - સ. -)

શ્રેષ્ઠ આપવાની બાબતને અવિકારીઓ જ્યારે હળવાશથી લે છે ત્યારે વ્યવસાયિકો અને શોખીનોનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપાતો નથી. કાસમ સમાના હેવાલને ટિપ્પણી વિના છાપીને 'વિહંગ' ટીકા નોતરી લીધી છે. ધણા લોકો કાસમને માનની નજરે જુએ છે, એ મારા ઘ્યાલમાં છે. કાસમના ઉત્સાહ અને શક્તિની મારા ઉપર

લિફ્ટિંગાવલોડન

પણ છાપ પડી છે. અગાઉના લેખકોના નિરીક્ષણમાં ભૂલ હોય જ નહીં એવું કહેવાનો આનો અર્થ નથી, પણ તેમનાથી જુદા પડતાં બધાં નિરીક્ષણોને સ્વીકારી લઈએ તો અભ્યવસ્થા ઉલ્લી થાય. દા.ત. મોટો રાજાલાલ (Scarlet Minivet) કૃષ્ણમાં નક્કી દેખાશો. એવી જ રીતે મેં જલદીથી કરેલ એક ઓળખ પરથી દિલહીની પક્ષીયાદીમાં રાખોરી અભાબીલ લટોરા (Ashy Swallow Shrike) નો ઉમેરો થએલો ! Mianert Shaganની મોટી છેતરપણીને લીધે જંગલ ચીબરી (Forest Owllet) નો ઉમેરો ગુજરાતની પક્ષીયાદીમાં થએલો. આપણો કોઈ યુવા પક્ષીનિરીક્ષક તે ચીબરીને જોઈ પાડે, તે મને જરૂર ગમે. રાજીપીપળા કે ડાંગનાં તુંગરાળ વનોમાં જંગલ ચીબરી હોવાનું અસંભવિત નથી. વિકમ સ્થાપવા કે મોટો જ્ઞાનકાર (expert) ગણાવા માટે નહીં પણ પંખીઓના નિરીક્ષણમાંથી મળતાં આનંદ માટે તે કરો. મારા બધા યુવાન મિત્રોને આ વાત ભારપૂરક જગ્ઘાવવાનું મને ગમશે. સામાન્ય પક્ષીઓ સાથે વધારે નાતો કેળવરો તો અચાનક આવી ચઢેલા અસામાન્ય પંખીને ગોતી પાડવાની આશ્ર્યજનક આવડત તમારામાં વિકસશે. અસામાન્ય

પંખીઓ શોધતા રહેશો તો આસપાસનાં પંખીઓ સાથે તમારો નાતો કેળવાશે નહીં. પરિણામે હિમતસિહણાએ નિર્દેશેલ કક્ષામાં તમે આવી જશો. આ લખાણ પૂરું કરતાં પહેલાં નીચેની બાબત જગ્ઘાવવી યોગ્ય ગણાશે.

કર્ણના અબડાસા તાલુકામાં નાનો શક્કરખોરો (Small Sunbird) અને ટપકીલો હોલો (Spotted Dove) જોયાનું સરકારશ્રીને મોકલેલ એક સરકારી હેવાલમાં જડાયું છે ! મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નર્મદાનાં નીર વહેતા થશે ત્યારે ઘણા બધા ફેરફાર થશે. આ ફેરફારોનું મૂલ્યાંકન કરવામાં અત્યારે ઉપલબ્ધ પુસ્તકો આધારભૂત પાયો બનશે. ડાંગમાં શિયાળો ગણવા કાશ્મીરી ચટકી માખીમાર (Kashmiri Redbreasted Flycatcher) આવતો હોવાની મને શંકા છે. આપણાં યુવા મિત્રોમાંથી જે કોઈ આની પુષ્ટી કરશે તેને મારા શુભાશિષ સાથે સુવાંગ યશ મળશે.

૧૪, જયત સોસાયટી, રાજકોટ-૩૬૦૦૦૪



નિરીક્ષણ નોંધ

અમદાવાદમાં ચિલોન્ટો !

તા. ૨૬-૮-૦૨ના રોજ સાંજે ૭-૩૦ વાગ્યે

એ.ઇ.સી., નારણપુરા પાસે માર્ક ઓટો કાઈનેટીક - શો- ૩૮ પાસે એક નર ચિલોન્ટો (Grey Hornbill) ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલો. ‘એનીમલ હેલ્પલાઈન’ ખાતે ફોન આવતા, શ્રી રાહુલભાઈ સાયગલ તે પક્ષીને લઈ આવ્યા હતા. તેઓએ એક દિવસ સારવાર કર્યા બાદ, તેને ત્યાં રાખ્યો હતો. પછી તેમણે તે પક્ષીને કંકરિયા ‘જુ’ ખાતે સુપ્રત કરી દીધું હતું. ‘જુ’ ખાતે એક માદા ચિલોન્ટો હતો. આ ચિલોન્ટો ક્યાંથી આવ્યો ? તે અંગે કશી જ ખબર પડતી નથી.

કાર્તિક શાસ્ત્રી

અશોકવાડી, પંચવટી, અમદાવાદ-૩૮૦૦૦૬



Sighting of Common Grey Hornbill !

In Sundervan, Ahmedabad, Grey Hornbill was sighted during the 3rd week of August, 2002. It was later seen again in Sundervan by Kandarp Kathju.

On passing on this information to Shri Lavkumar Khachar and Shri Lalsinhji Raol they were delighted and sad at the same time. The bird could also be an escape from captivity.

Rajendrasinh Jadeja

Sundervan, Satellite Road, Ahmedabad 380 015





કુજનું આગમન

તા. ૧૭-૮-૨૦૦૨ના રોજ સાંજે ૪-૩૦ થી ૫-૦૦ દરમિયાન તથા ૧૮-૮-૨૦૦૨ના રોજ સવારે ૭-૦૦ થી ૭-૩૦ દરમિયાન ભાવનગર - ધોલેરા રોડ ઉપર, ભાવનગરથી ૨૦ થી ૨૫ ક્રિ.મી.ના અંતર સુધીમાં રસ્તાની બંને તરફ દૂર સુધી કુજ પથરાયેલી જોઈ. કુજનાં ટોળાં છૂટાંછવાયાં પથરાયેલાં હતાં તથા ટોળાંમાં કુજની સંખ્યા જુદી જુદી હતી. કુલ સંખ્યા હજારોમાં હશે, પરંતુ અંદાજ માંડવો મુશ્કેલ છે. દર વર્ષ, સાએમબરનાં પહેલાં - બીજા અઠવાટિયા દરમિયાન આ વિસ્તારમાં કુજ અચૂક જોવા મળે છે.

આ જ વિસ્તારમાં, મીઠાના અગરમાં, નાનાં તથા મોટાં હજ (Flamingo) પણ જોવા મળ્યાં હતાં.

(૧૧-૮-૨૦૦૨ના રોજ ભાવનગર- ધોલેરા રોડ ઉપરથી પસાર થયો પરંતુ એક પણ કુજ જોવા મળી નહીં. પરંતુ ૨-૮-૨૦૦૨ના રોજ દિવસાંત પારાશર્ય આ જ રસ્તા ઉપરથી પસાર થયો, તેણે ભાવનગર-નારી ચોકડી પાસે માત્ર બે કુજ જોઈ. આમ ૧૫ દિવસના સમયગાળામાં કુજની સંખ્યા વધી એમ લાગે છે. - ભવભૂતિ પારાશર્ય, આણંદ)

કાલિદી પારાશર્ય

બી-૨૮૬, સૌરભ પાર્ક, સુભાનપુરા, વડોદરા-૩૮૦૦૨૨



લેવાની માળા સામગ્રી

પક્ષીઓ પોતાના માળા માટે આજુભાજુમાં જે વસ્તુઓ ઉપલબ્ધ હોય તેમનો કેવો ઉપયોગ કરે છે, તે નિરીક્ષણ કરવા જેવું છે. મારી બારી સામે જાળીની બહાર કરોળિયાનાં જાળાં હોય તો, અનેક વખત શક્કરખોરાને તે જાળા લઈ જઈને પોતાના માળાના બાંધકામમાં વાપરતા જોયા છે. કરોળિયાના જાળાની ચીકાશ માળાને મજબૂત બનાવે છે. કાગડાઓ લોંઝંડના નાના નાના. તાર લઈ જઈને મજબૂત માળો વર્ષો સુધી ઉપયોગમાં લેતા મેં જોયા છે. ખાસ કરીને યુકેલીપ્ટસ, લીમડા જેવાં વૃક્ષો ઉપર કાગડાઓનાં કાયમી ઘર નજરે ચક્કા છે અને વર્ષોવર્ષ તેઓ તેનો ઉપયોગ કરે છે.

'સેવન સિસ્ટર્સ' તરીકે ઓળખાતાં લેલા, બગીચામાં અવાજ કરતાં જોવા મળે છે, પરંતુ નાળિયેરના નાના છોડના

એક રેસાને ચાંચ વડે જોરથી પકડી, થોડું કૂદી, પાછા જમીન ઉપર પટકાઈને, રેસા તોડી તેની સબીનો ઉપયોગ માળામાં કરતાં જોઈને આશ્વર્ય થયું ! નાળિયેરના છોડના નવા ઊગતાં પાન કોણ તોડી નાખે છે તેનું આશ્વર્ય ધણા વખતથી થતું હતું, પરંતુ એક દિવસ લેલાને આ રીતે પાન તોડતા જોઈ આ ગુનેગાર નજરે ચક્કા ! જો કે, ત્યાર પછી તો લેલાને આ રીતે નાળિયેરના નાના છોડના રેસા તોડતા જોવાનો મોકો ધણી વાર મળ્યો. પક્ષીઓ માળાના બાંધકામ માટે જે 'બીલીંગ મટીરીયલ' વાપરે છે, તેના ઉપર કોઈ પુસ્તક છે કે નહીં, તે ખબર નથી, પરંતુ આ ક્ષેત્રનો અભ્યાસ કરવો રસમય જરૂર બને, તેમ હું માનું છું. ('Nidification of Indian Birds' માંથી માહિતી મળી શકે- લા.)



બુલબુલ અને કાંચંડો

માળામાંથી પોતાનું બચ્ચું બહાર નીકળે તે સમયે પક્ષીઓ તેની ડેવી માવજત કરતા હોય છે, તે જોવાને એક આનંદ હોય છે. માળામાં બચ્ચાને પોપણ આપવા માટે જરૂરી કાંચળ લીધા બાદ, બચ્ચું માળામાંથી બહાર નીકળે ત્યારે તેની સુરક્ષિતતા, ભરણપોષણ અને તાલીમ આ બધા માટે પક્ષીઓને પ્રયત્ન કરતા જોવા, એ એક મળ્યા છે.

એક દિવસ સવારે, બુલબુલના અવાજ ઉપરથી લાગ્યું કે આંચ બચ્ચું માળામાંથી બહાર નીકળ્યું લાગે છે. બીજે દિવસે પણ એવો જ અવાજ સંભળાયો. હું બહાર નીકળ્યો તો મેં જોયું કે, બારી ઉપર એક જગાએ બચ્ચું બેહું હતું ને માતાએ નીચે પડેલાં પાંદડાં વીખીને એક નાનું કાંચંડાનું બચ્ચું પૂછીયાથી પકડ્યું હતું, જેને પછી ખુલ્લી જમીન ઉપર મૂક્યું. કાંચંડાનું બચ્ચું ચાર પાંચ ઈંચ લાંબું હતું. તેને પગથી પકડીને ચાંચ મારીને બેભાન કરી દીધું અને પછી બુલબુલે કાંચંડાના બચ્ચાનું ગણું જોરથી દબાવી રાયું. આ રીતે કાંચંડાનું બચ્ચું નિષ્પાણ થતાં તેણે તેને પકડીને પોતાનું બચ્ચું જાણી પાસે બેહું હતું ત્યાં લઈ આયું. તરત જ બુલબુલના બચ્ચાએ મોહું પહોળું કર્યું, એટેલે કાંચંડાના બચ્ચાનું મોહું માતાએ પોતાના બચ્ચાના મોકામાં દાખલ કર્યું. મારા આશ્વર્ય બચ્ચે મેં જોયું કે, બુલબુલનું બચ્ચાને થોડી જ વારમાં આ કાંચંડાના બચ્ચાને આયું ને આયું ગળી ગયું અને થોડી જ વારમાં સ્વસ્થ થઈ ગયું. પક્ષીઓને, પકડેલા શિકારના નાના નાના ટુકડા કરી બચ્ચાને ખવરાવતા મેં

નિર્વિક્ષણ નોંધ

અનેક વાર જોયા છે, પરંતુ આ રીતે શિકારને આખ્યોને આખ્યો ગળી જતા પહેલી વાર જોવા મળ્યું.

દિનુભાઈ દવે

નિયામક, શારદામંડિર, અમદાવાદ-૩૮૦૦૦૭



અલગઅલગ શક્કરખોરાની જોડીમાં જોવા મળેલી સ્વતંત્ર વર્તણું

૧૯૮૦ની સાલમાં મારા ઘરની પરસાળમાં એક શક્કરખોરાની જોડીએ તાર પર સુંદર માળો બનાવ્યો હતો. તેઓ તેમનાં બચ્યાને મોટું કરી સલામત ઉડાવી ગયાં હતાં. તે પક્ષીઓની માળા બનાવવાની રીત, ઈડાંને હૂંફ આપવાનો સમય, બચ્યાને સાચવી ખોરોક આપવાની રીત અને રક્ષણ કરવાની રીત અનુભવી પંખીઓ જેવી હતી. એટલે તે આ અગાઉ બચ્યાને ઉછેરી ચૂક્યાં હોય તેવાં અનુભવી લાગ્યાં.

બીજી જોડીએ એ જ માળાને ઠીક કરી ઉપયોગમાં લીધો. પણ એ માદા ઈડાં સેવનમાં જ કાચી માલૂમ પડી. તેણે એક ઈડું સેવ્યું જ નહીં. તેઓએ એક જ બચ્યું ઉછેરું અને મોટું કરીને લઈ ગયાં.

તીજી જોડી જોવામાં બહુ નાજુક લાગતી હતી. પ્રથમ વાર જ તેઓ માળો કરવા આવ્યાં હોય તેમ લાગતું હતું. જૂન માળાને તેમજે ધીમેધીમે સાંઘ્યો. માદાએ ઈડાં મૂક્યાં. સાંજે ઘણી વાર માદા જોડી પરસાળમાં દાખલ થતી, ત્યારે શિયાળામાં અંધારું થઈ જતું. ‘લાઈટ’ કરીને હું એને માળો બતાવવા પ્રયત્ન કરતો. રાત્રે કોઈ વાર કામથી ઘરમાંની ‘ટ્યૂબલાઈટ’ ચાલુ થતી ત્યારે માદા માળામાંથી નીકળી ઘરમાં આવી જતી. એ સમયે એને પાછી માળામાં મોકલવા અમારે બહુ મહેનત કરવી પડતી! બચ્યાં-ઉછેરમાં એ બીજી જોડીઓ જેટલા ફેરા કરતા નહીં. છેલ્લે તેઓ ચકલી સાથે લડાઈમાં ઊતર્યા! એમાં તેમનું બચ્યું પણ માળામાંથી પડીને મરી ગયું!

બીજી જોડીનું જ્યારે બચ્યું થયું ત્યારે કંઈક નવી જ બાબત જોવા મળી. માદા વહેલી સવારે ઊડીને બહાર જતી રહી. એને જોઈ નર ઊડીને વાયર પર તેની સાથે નંસી ગયો. ત્યારે માદા ઊડીને પરસાળમાં આવી ગઈ. એ

જોતાં જ નર ઊડીને ખાસ પ્રકારનો અવાજ કરતાં માળા પર બેસીને નવા જન્મેલાં બચ્યાંને જોવા લાંઘ્યો. જાણો નર-માદા ખાસ પ્રકારનો આનંદ લઈ રહ્યાં હોય તેમ પ્રતીત થતું હતું!

આ પરથી એમ ફ્લીત થાય છે કે, દરેક માણસનું જેમ અલગ જ વ્યક્તિત્વ હોય છે, તેમ પક્ષીઓમાં પણ હોઈ શકે ધડાયેલી વ્યક્તિ સાંદું કામ કરે, તેમ પ્રથમ જોડી બચ્યાં ઉછેરવામાં સફળ રહી. બીજી જોડી એક જ બચ્યું મોટું કરી લઈ ગઈ. જ્યારે ત્રીજી જોડી બેકાળજીવાળી અને અપરિક્ષ્ય લાગી. તેઓ એક પણ બચ્યું બચ્યાવી શકાયાં નહીં.

બેન્જામિન સુવાર્તિક

જુઓલોજિઓપાર્ટમેન્ટ, ફિલ્ડી ઓફ સાયન્સ, એમ.એસ.યુનિવર્સિટી, વેદરા



આજી-૨ બંધ અને ચોમાસુ વિહંગો

પ્રથમ વરસાદ બાદ, આજી-૨માં પાણીનો થોડો આવરો થતાં જ, બંધ-હેઠવાસની નદી-પટનાં ટૂંકા જવંત રહેતાં ચિયા ખૂબ જડપથી ઊગવા માંડે છે. નદીમાં ભરાયેલ પાણીમાં સાથે સાથે પાન-ફૂટી પોતાનો વિસ્તાર ફ્લાવે છે. બંને કાંઠાના ગાંડા બાવળ ગીય બને છે. આ ચોમાસુ પરિસર તેનાં રહેવાસી પક્ષીઓને ઈજન આપતું હોય તેમ, થોડા સમયમાં જ આ ચિયા, ચોમાસુ વિહંગોની હરફર, ચહકાટ અને રંગોથી શક્ષણારાઈ જાય છે.

જુન અંતનાં સારા વરસાદ બાદ, તા. ૭-૭-૦૨ની પ્રથમ મુલાકાતે ચિયાં ટૂંકા હતાં. પાનસુગરીઓ (Blackheaded Weaver Bird) કે પાનબગલી (Bittern) હજુ આવી ન હતી, પરંતુ એક પાન ફડકુફૂતી (Indian Wren - Warbler) ને તે ચિયામાં માળો ગુંથતી જોઈ.

તા. ૨૭-૭-૦૨ની સાંજ વેળાએ જઈને જોયું તો, નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. ચિયા ઘણાં વધી ગયા હતાં. ગીય થયેલ ગાંડા બાવળ વચ્ચે રસ્તો ખોળી પાણીમાં ચિયા નજીક જતાં પાનસુગરીઓનું ગાન સાંભળ્યું. તેણે ચિયાના છેડા બાંધી, માળો બનાવવાનું શરૂ કર્યું હતું. પાણીમાંના ઊચા-નીચા પત્થરો પર સંતુલન જાળવી, ઉગેલ તરતી વનસ્પતિઓ પસાર કરતાં આગળ વધ્યો અને એક મોટી શિલા પર જઈ નિરાંતે ઊભો. સાવ નજીક જ અડીને

(ગેલ ચિયાનાં ઝુંડમાં એક માળો નજરે ચડ્યો. ગયા વર્ણના અનુભવે ઓળખી ગયો, “આતો શ્યામશિર મુનિયા (Blackheaded Munia)નો માળો !” ગોળ માળાનો પ્રવેશ ઊડાપાણી તરક હતો. થોડે દૂર મંથીમારી કરતાં છોકરાઓ મારું નિરીક્ષણ કરતાં હોઈ પાણીમાં ઊતરી માળો તપાસ્યો નહીં. બીજી તરફનાં ચિયામાંથી અજાણ્યો, ફૂટીનાં તાલનો રણકતો, મોટો અવાજ સંભળાયો, પક્ષી જોવા મળ્યું નહીં. આગળ વધી, રસ્તા પછીનાં ચિયામાં પ્રવેશ્યો. સંધ્યા સમયે ચિયામાં જાણે કદી ન બોલતાં મૂંગા વિહંગો બોલવાનું શરૂ કરે છે. તેમાં છે, નડી બગલો (Purple Heron) અને સફેદ છાતી સંતાકૂકડી (White -breasted Waterhen). બજરિયા સફેદ રંગોના વિરોધાભાસથી શોભતી ઈ શ્યામશિર મુનિયાને ગાંડા બાવળ પરથી જમીન પર અને ફરી જાડ પર જતી નિહાળી. ગયા ચોમાસે ત જોયેલ, તે હવે ઈ થઈ. આ વિસ્તાર જરૂર તેને ગમ્યો, ફણ્યો જગાય છે ! ૨ સુરંગી પાન-બગલી (Chestnut Bittern) ઉપરથી પસાર થતાં જ તેનું આગમન નિશ્ચિત થયું. ફરી પેલો ફૂટી જેવો દમદાર અવાજ સાંભળ્યો. ચિયામાં દૂરભીનથી ખાંખાખોળાં કરતાં ટોચે બેસી બોલતું પકડી પાડ્યું. સાવચેતિથી નજીક જઈ ઓળખ્યું તો તે હતું મોટો પાન કરકરિયો (Great Indian Reed Warbler). બોલતી વેળા ચાંચ પહોળી રાખતા તેનું અંદરનું ગુલાબી-લાલ મુખ સ્પષ્ટ દેખાતું હતું. આ જોઈ તુરંત માનનીય શ્રી લાલસિંહભાઈની ‘પાણીના સંગાથી’ માં કરેલું તેનું વર્ણન યાદ આવ્યું. તે આમ તો ચોમાસા બાદનો મુલાકાતી છે, પરંતુ બે પક્ષીને સતત સામસામા બોલતા સાંભળી તે સંવનનની બોલી લાગી. તે અહીં પ્રજનન કરતો પણ હોય, તેવો ઉત્સેખ ‘બર્ડજ ઓફ સૌરાષ્ટ્ર’ તથા ‘પાણીના સંગાથી’ માં છે. સંધ્યાનો આછો પીળો પ્રકાશ ગંખો થયો હતો. મેં પાછા ફરવાનું શરૂ કર્યું. વળાંક વળતાં ગાંડા બાવળની ટોચે બેઠેલી સુરંગી પાન-બગલી (Chestnut Bittern) જોઈ. થોડી વાર દૂરભીનથી નિહાળી ત્યાં તો તે ઊડી ચિયામાં બેઠી. ફરી ત્યાંથી ઊડી નજીક જ ઊતરી. પાછા ફરવાનું શરૂ કરતાં થયું કે, “લાવ તપાસ તો કરું, ચિયામાં ત્યાં માળો તો નથી ને ?” થોડાં ચિયા તપાસ્યા તો તેની વચ્ચે ઉગેલ ચિયાની ગુંધેલી લીલી ટોપલી (Basket) માં પીળાશ પડતાં સફેદ, બદામી ડાઘાવાળાં ચાર ઈડાં હતાં. માળો પ્રથમ વાર જ જોયાના આનંદથી પ્રહૃદિલત થઈ પાછો ફર્યો. સંદર્ભ તપાસતા, ડૉ. સલીમઅલીની ‘બુક

ઓફ ઇન્ડીયન બર્ડજ’માં ઈડાંનો રંગ સફેદ લખાયેલ છે. પરંતુ આ મુંજવણનો ઉકેલ ‘બર્ડજ ઓફ સૌરાષ્ટ્ર’માં મળ્યો. આર.એસ. ધર્મકુમારસિંહજી લખે છે કે, નાની દૂલ્ધીની જેમ સુરંગી પાન-બગલીનાં ઈડાં પણ શરૂઆતના સફેદ રંગ બાદ ડાઘાવાળા બને છે.

તા. ૩૧-૭-૦૨ની સાંજે આ ચિયા-પરિસરથી આકારાઈ ફરી હું, ભૂપણભાઈ અને આસગરભાઈને પણ ખેંચી ગયો. પેલો શિલા પરનો શ્યામશિર મુનિયાનો માળો પાણીમાં ઊતરી તપસ્યો. માળામાંથી પક્ષી ઊડ્યું. તેમાં પાંચ સફેદ નાના લંબગોળ ઈડાં હતાં. આસપાસમાં અન્ય ત મુનિયા પણ જોઈ. અચાનક બે પીળી પાનબગલી (Yellow Bittern) ઝડપથી ચિયાનાં મૂળ પાસેથી ઊડી અને થોડેક અંતરે ચિયામાં બેઠી. ભૂપણભાઈએ ચિયાના વેરવા વચ્ચે બેઠેલી પકડી પારી. બધાએ દૂરભીનથી નિરાંતે નિહાળી. જે જગાએથી તે ઊડી હતી તે તપાસવા ઊડાપાણીમાં ઊતરી, ચાલ્યો. તેણે માળા માટે ચિયાનું ‘ખેટફિર્મ’ બનાવવાનું શરૂ કર્યું હતું. રસ્તા પછીનાં ચિયામાં, પાણીકાંઠે, સફેદછાતી સંતાકૂકડી ખૂબ જ વિચિત્ર અવાજે બોલતી હતી. બે નાની સિસોટી ભાતક (Lesser Whistling Teal) અને ચારેક નયનરથ્ય જલમાંજર (Jacana) અમારી ઉપરથી પસાર થયા. ચાતક (Piedcrested Cuckoo) નો મીઠો બોલ પણ સંભળાયો. સુરંગી પાન-બગલીના માળાની જગાએ ગયા. આશ્ર્ય સાથે માળો હતો નહીં. ઢોર પસાર થવાનો રસ્તો હોવાથી માળાનો નાશ થયો હોય.

તા. ૭-૮-૦૨ની મુલાકાતે પીળી પાનબગલીનો માળો વધુ તૈયાર થઈ ગયો હતો. બે પક્ષીને ઊડતાં પણ જોયાં. સુરંગી પાનબગલી કંઠાનાં બાવળ પર બેસી અનુનાદિત સ્વરમાં બોલતી પ્રથમ વાર સાંભળી. દૂરથી સામો જવાબ પણ આવતો હતો. તે એક બીજાનો પીછો કરતી હતી. આ બધું તેની સંવનન ડિપા (Courtship Display) હતી. આ વખતે ફરી મોટા પાન કરકરિયાને સાંભળ્યો. પાનસુગરીના માળા સંપૂર્ણ તૈયાર થઈ ગયા હતા. તપખીરી સંતાકૂકડી (Brown Crake) અને સફેદછાતી સંતાકૂકડીનાં ઊંચા સૂર વાતાવરણને જીવંત-વેગીલું બનાવતા હતા. એક ફડકૂકટી (Ashy Wren Warbler) ચાંચમાં જીવડા સાથે, મને જોઈ ચેતવણી સૂર આલાપતી હતી.

દસ દિવસ બાદ બંધનાં દરવાજા ખોલી, નહીંમાં

પાણી છોડાશે, તે જાણી થયું હુંખ થયું કે, બધું નાચ થઈ જશે. વરસાએ ખેચાતા સિંચાઈ માટે એ જરૂરી પણ હતું. તા. ૨૧-૮-૦૨ એ જઈને જોયું. બધાં ચિયા મૂળ પાસેથી પાણીના જોરથી તુટેલાં હતાં. વાતાવરણ શૂન્ય લાગ્યું. હતાશ થઈ પાછો ફર્યો. આ ગમગીની કદાચ વિહંગોને નહીં હોય. તે થોડા જ સમયમાં ઉદ્યમી થઈ ફરી જીવન-કિયા આરંભી દેશે!



કાળીડોક ટોક (Black-necked Stork) નું નૃત્ય

આજુ-૧ બંધમાં થોડું - વાતું પાણી આખા ઉનાળા દરમિયાન રહ્યું, આથી રહેવાસી પક્ષીઓનો ત્યાં ધામો હતો. તા. ૩-૬-૦૨ ના રોજ આ પૈકી, ૧૦૦ થી ૧૫૦ની સંખ્યામાં નાની સિસોટી બટક (Lesser Whistling Teal), નકટા (Comb Duck), નાની ઝૂબડી (Little Grebe) ક્રાંતો પોતપોતાની ભોજન પ્રવૃત્તિમાં મશગૂલ હતાં અથવા તો નિરાંતે સંકોચાઈ, કંડે આરામ ફરમાવતો હતાં. પાણી ઘટતાં રચાયેલ બેટડાં પર કેંચીપૂછ વા-ખગલી (River Tern)-ની માળાવસાઈત બનેલ. તેમજ ગજપાંડુ (Blackwinged Stilt) અને કંઠલાવાળી નાની ઢોંગલી (Little Ringed Plover) એ પણ માળા બનાવ્યા હતાં. આ સર્વેમાં, આ વર્ષ વિશિષ્ટ મહેમાનો બે કાળીડોક ટોક હતા. માર્યથી જૂન સુધી તેમજે ચાતુર્મસ ગાળવા આજુ-૧ પસંદ કર્યો હતો. આ દરમિયાન, તા. ૨૧-૪-૦૨ ના સંંજ ગાળવા બંધના પાછળના રસેથી જઈ એક ટેકરી પર, હું, મારી પત્ની ભાવના સાથે જઈ બેઠો. એક કાળીડોક ટોક કંડે સ્થિર ઊભો હતો. બીજો છીછરા પાણીમાં હતો. જે પાણીમાં હતો તેણે બસે પાંખ આસ્તેથી ફરજાવવાનું અને નાના કૂદકા મારવાનું શરૂ કર્યું. મને થયું, આ સારસ જેવું સંવનન-નૃત્ય છે કે કેમ? પરંતુ ત્યાર બાદ તુર્ટ તેણે પાણીમાંથી કંઈક પકડવા પ્રયત્ન કર્યો. એટલે આ નૃત્ય, ઢોંકની ખોરાક મેળવવા માટે વિકસાવેલી એક રીત હતી, એમ લાગ્યું.



કાળિયા કોશીનો માળો, વીજળીના તાર ઉપર

રાજકોટમાં સરદાર પટેલ સ્નાનાગારની મુલાકાત વખતે પક્ષીઓમાં ખાસ રસ લેતા એક કર્મચારીએ મને જગ્યાવ્યું કે, “સ્નાનાગારના પાણી પર ઊરીને જીવણ

પકડતા કાળા પક્ષીએ દરવાજા બહાર માળો બનાવ્યો છે.” ત્યાં જઈ જોયું તો, રસ્તાના ભરચક ટ્રાફિક વચ્ચે, ઊચા થાંબલા પર, તાર જ્યાં આડા અંગલ પર બંધાય છે, તેની ગાંઠ પર રેસાઓ ગુંધી બનાવેલ માળા પર કાળિયા કોશી બેઠો હતો. બીજો કોશી નજીક નિરીક્ષણ કરતો અન્ય તાર પર બેઠો હતો. તે હતો ચોકીદાર. કાબરો અને કાગડાઓને નજીક ફરકવા પણ દેતો ન હતો. થોડા દિવસ બાદ અગાશી પર જઈ જોયું તો, માળો ખાલી હતો. લગભગ મહિનાબાદ જૂન માસમાં મુલાકાત વખતે કાળિયા કોશીને માળામાંના બચ્ચાને ખવડાવતા જોયો. કાળિયા કોશીને પ્રથમ વાર જ વીજળીનાં તાર પર માળો બનાવતા જોયેલ. કાળિયા કોશીની તસવીર પાડવા બે દિવસ બાદ ભૂખણભાઈ સાથે અગાશી પર ગયા ને તુર્ટ જ એક મોટા કૂદાને લઈ કોશી આવ્યો. બચ્ચાને ખવડાવી તરત માળા પર બેસી ગયો, જેથી આજુબાજુની સંખ્યાબંધ કાબરો અને કાગડાઓથી બચ્ચાને રક્ષણ મળે.

અશોક મશ્શુ

અ-૭, આલાપ ડેરીટેજ, સત્ય સાંદર્ભિક્સ્પ્રિટલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ



પક્ષીઓની અસામાન્ય ચાંચ

પક્ષીઓની ચાંચ, ઊપલું પાંખિયું (Mandible) અને નીચલું પાંખિયું એમ બેનાં જોડાવાથી બનતી રચના છે, જે એક સખત રચના છે. અમે ધણાં એવાં પક્ષીઓને જોયાં છે, જેઓની ચાંચ કંઈક અંશે અનિયમિત કે અસામાન્ય કહી શકાય તેવી હોય અને આ જોતાં હમેશાં પ્રશ્ન થતો હોય છે કે, પક્ષીઓનું ખોરાક ગ્રહણ કરવાનું એક માત્ર અંગ જ જો અસામાન્ય હોય, તો તેઓ શી રીતે ખોરાક લઈ શકતાં હોશે? પરંતુ આ અસામાન્ય પરિસ્થિતિ સાથે તાલમેલ કેળવવામાં પક્ષીઓ, માણસની જેમ જ પાવરથા હોય છે! અહીં અમારા ‘કુમ્પસ’માં આવેલ શીમળા (Silk Cotton Tree) ઉપર એક ઊરનારી કાગડો (Jungle Crow) ને બેઠેલો જોયો હતો, જેનું ઊપલું પાંખિયું નીચલા પાંખિયાથી નાનું અને ઉપરની બાજુએ લગભગ ૪૫૦ના ખૂણો વળેલું હતું, તેમ છતાં આ કાગડો આ જાડાના મોટાં લાલ ફૂલમાંથી રસ ચૂસી રહ્યો હતો. જ્યારે, બીજો એક કાગડો કે જેનું ઊપલું પાંખિયું શક્કરખોરા (Sunbird)-ની જેમ નીચેની તરફ લંબાયેલું અને નીચેના પાંખિયાથી લાંબુ હતું, તે સિમેન્ટની કોઠીમાંથી પાણી



(Jungle Crow)



(Jungle Crow)



(Brahminy Myna)




(Jungle Babbler)



(Homing Pigeon)

Diagrammatic representation of deformed beaks as observed in nature.



પી રહ્યો હતો. એક એવો જ કાગડો શ્રદ્ધામાં નાખેલ ભાતને મુશ્કેલી સાથે, મોહું આહું રાખ્યો ખાતા જોયેલો.

આ ઉપરાંત, અમારા પક્ષીનિરીક્ષણ દરમિયાન એક બ્રાહ્મણી મેના (Brahminy Myna) જોઈ હતી, જેનું ઉપરનું પાંખિયું કડીની જેમ વળેલું હતું. આમ છતાં એ સીફતથી ખોરાક ગ્રહજી કરી રહી હતી.

આ રીતની વળેલી ચાંચવાળું, સફેદ, પાળેલું કબૂતર સપનાબેનના બાપુજીનાં 'કલેક્શન'માં છે. જેને ખાવામાં તકલીફ ન પડે તે માટે તેમજો તેની આ વળેલી ચાંચ થોડી કાપી નાખી છે અને તે હવે સરળતાથી દાઢા ચક્કી શકે છે.

એક વન લલેડા (Jungle Babbler) ને તેના સાથીઓ સાથે ચૂક્યા પાંદડાં ઉપર ફૂદતું જોયું હતું, જેનાં બંને પાંખિયાં સામાન્ય કરતાં લાંબા અને એક બીજાથી વિરુદ્ધ દિશામાં વળેલાં હતાં. ઘડી વખત તેને જોયાં કરતાં અમને લાગ્યું કે, તેમની આ અસામાન્ય ચાંચ તેમની ખોરાક ગ્રહજી કરવાની પ્રક્રિયામાં બાધા નાંખતી ન હતી, જે આશર્ય હતું!

વધુમાં કહું તો, પક્ષીઓની ચાંચની અનિયામિતતા

સમજવી કે જાણવી ખૂબ જ જરૂરી છે. તે જાણવા આવી ચાંચની આંતરિક રચના (anatomy) સમજવી જરૂરી છે. શું આપણે આવી અસંગતતાને જનીનિક (genetic), કે વિકાસલક્ષી ખામી (developmental deformity) કે કોઈ રોગ ને લીધે થતી ખામી સાથે સરખાવી શકીએ? (જુઓ : 'આસની ચાંચ', રક્ષા ભક્ત, પા. ૧૧, 'વિહંગ' સર્ણગ અંક ૧૧)

સપના સુરેન્દ્રન, ગ્રાવા વિરેન્દ્રસિંહ એમ.
ઉપાઈમેન્ટ ઓક ઝુઝોલોજી, ફેફલી ઓક સાપન્સ, મ.સ. પુનિવર્સિટી, વડોદરા



માળા બનાવવા વીજળીના તારનો
(ઉપયોગ કરતા શક્કરખોરા

તા. ૩-૪-૦૨ના રોજ આણંદના જાગનાથ
વિસ્તારમાં આવેલ એક કરિયાણાની દુકાનના દરવાજાની ઉપરની બાજુએ વીજળીના તાર ઉપર લટકતો શક્કરખોરા (Purple Sunbird)નો માળો જોયો. લટકતા તારના 'U' આકારના છેડાની આસપાસ શક્કરખોરાએ માળો બનાવ્યો હતો, જે જમીનથી આશરે આઈ ફૂટની ઊંચાઈએ હતો.

નિરીક્ષણ નોંધ

હુકાન કરિયાડાની લોવાથી, દિવસ દરમિયાન ઘણી અવરજવર રહેતી હતી. હુકાનની બહારના 'કમ્પાઉન્ડ'ને અરીને તથા સામેની તરફ અનેક નાનાં મોટાં વૃક્ષો હતાં, આમ છતાં આટલી માનવ-વસ્તી વચ્ચે માળો બાંધવાનું પ્રયોજન શું હશે? (શક્કરખોરા માળા માટે માનવ વસ્તી નજીકના સ્થળ વધારે પસંદ કરતા જણાય છે. માનવ હરફરને લીધે કાગડા, ધોંખરા જેવાં ઈડાંખોર પંખીઓથી તેને મળતી સલામતી, એ એક કારણ ગણાય. - લા.) ખુરશી કે ટેબલની મદદથી માળા સુધી પહોંચે શકાય તેમ હતું. માળાનું નિરીક્ષણ કરતાં તેમાં ઈડાં જણાયાં નહિ. માત્ર માદા પક્ષીની અવરજવર ચાલુ હતી. તા. ૧૨-૪-૦૨ના રોજ માળામાં ત્રણ ઈડાં જોઈ શકાયાં. આ દરમિયાન, હુકાનદાર પણ સતત માળાનું નિરીક્ષણ કરતો. આ પછી માદાને ઈડાં સેવતી જોઈ. તા. ૨૦-૪-૦૨ના રોજ બચ્ચાં પણ જીયાં.

તા. ૨૮-૪-૦૨ના રોજ જોરથી પવન ફૂકાતા માળો તારથી છૂટો પડી ભોય ઉપર પડ્યો. હુકાનદારે તેને સલામતી સાથે પ્લાસ્ટિકની થેલીમાં મૂકી ફરી લટકાવ્યો. માળામાંનાં બચ્ચાને ઈજા થઈ ન હતી. માળામાં હવાની અવરજવર રહે તે માટે હુકાનદારે થેલીમાં અનેક કાણાં કર્યા હતા. માળો પડવાથી અસ્વસ્થ થયેલી માદાએ ત્યાર બાદ બચ્ચાને ખવડાવવાનું ફરી ચાલુ કર્યું.

તા. ૬-૫-૦૨ના રોજ નિરીક્ષણ કર્યું ત્યારે માળામાં બચ્ચાં જણાયાં નહીં. આસપાસ માદા પણ દેખાઈ નહીં. હુકાનદારના કહેવા પ્રમાણે, છેલ્લાં બે-ત્રણ દિવસથી, માળામાંનાં બચ્ચાને એક ચકલી (House Sparrow) વારંવાર પરેશાન કરતી હતી. ક્યારેક માળા ઉપર તો ક્યારેક બચ્ચાં ઉપર ચાંચ મારી હુમલો કરતી હતી. શું માળામાંનાં બચ્ચાં ચકલીના હુમલાથી નાશ પામ્યા હશે?

માળો બનાવવા માટે વીજળીના તારનો આધાર તરીકે ઉપયોગ કર્યો હોય તેવો શક્કરખોરાનો બીજો માળો ફૂલી મહાવિદ્યાલયની પાછળ 'ગ્લાસ હાઉસ' પાસે જોયો. અહીં વીજળીનો તાર જમીનથી આશરે અગિયાર ફૂટની ઊચાઈએ હતો. તા. ૩-૪-૦૨ના રોજ માદાને આ તારની આસપાસ માળો બનાવતી જોઈ. આ માળામાં ત્યાર બાદ બચ્ચાં પણ થયા હતાં અને તેને નર અને માદા બંને ખોરાક

આપતાં હતાં. માત્ર ૧૫-૨૦ ફૂટના અંતરે બોગનવેલ, કાજુ, અશોક, લીમડો વર્ગેરનાં વૃક્ષો છે, તેમ છતાં વીજળીના તાર ઉપર ખુલ્લામાં શક્કરખોરાએ માળો કેમ બનાવ્યો હશે? (જુઓ: 'વિહંગ' અંક-૨, વર્ષ-૨, ગ્રીઝ-૮૮, પા.૬: મધ્યૂર મિસ્ટ્રી તથા વિહંગ સંલગ્ન અંક ૮, પા.૭૧: દિનુભાઈ દવે.)



લાંબવેલમાં પક્ષીઓના માળા

જૂન-જુલાઈ, ૨૦૦૨ દરમિયાન બે-ત્રણ વખત લાંબવેલ તળાવ (આશંકાથી પ ડિ.મી. દૂર, ખોડિયાર મંદિર પાસે)ની મુલાકાત લીધી. વચ્ચેથી પસાર થતા, રેલવેના પાટાથી બે અસમાન ભાગોમાં વહેંચાયેલા આ તળાવ ઉપર તથા આસપાસ, પક્ષીઓનો મેળો જાઓ હતો. પક્ષીઓ માળા બનાવવામાં, ઈડાં સેવવામાં કે બચ્ચાને ખવડાવવામાં વસ્ત હતાં.

તા. ૧૧-૬-૦૨ના રોજ તળાવ નજીકના દેશી બાવળની ડાળ ઉપર પીળક (Golden Oriole) નો માળો જોયો. સૂક્ષ્મ ઘાસની મદદથી બનાવેલો આ માળો ગોળ તથા વચ્ચેથી ઊરી હતો. માળામાં માદા પક્ષી બેઠેલું લોવાથી ઈડાંની સંખ્યા જાણી શકાઈ નહીં. થોડી વારમાં નર પક્ષી માળા પાસે આવ્યું. તેની ચાંચમાં એક કીટક હતું, જે તેણે ઈડાં સેવતી માદાને ખવડાવ્યું (courtship feeding) અને ફરી ઊરી ગયું. માળો આશરે ૨૦ ફૂટની ઊચાઈએ હતો અને નીચે પાણી હતું, તેથી સુરક્ષિત હતો.

બાજુના ગોરસ આંબલીની ડાળ ઉપર એક કાળિયા કોશી (Black Drongo) નો માળો હતો. તે પીળકના માળાથી દસેક ભી.ના અંતરે હતો. માળામાં ઈડાં કે બચ્ચાં જોઈ શકાયા નહીં. માળાની આસપાસ બે કાળિયા કોશી હતા, જે આંબલીના વૃક્ષ પર બેસવા આવતા કાગડા, કલકલિયા વગેરે પક્ષીઓને શોરબકોર કરી દૂર ભગડતા. વૃક્ષ ઉપર ડેકડા મારતી નાચણ (Whitebrowed Fantail Flycatcher) જોઈ, પરંતુ તેનો માળો દેખાયો નહીં.

આ સ્થળથી આશરે એક ડિ.મી.ના અંતરે દેશી બાવળ ઉપર, તા. ૨-૭-૨૦૦૨ના રોજ એક પીળકનો માળો જોયો. માળામાં એક બચ્ચું હતું. માળાની આસપાસ ફરતાં નરમાદા પક્ષીઓ ઉપરોત અન્ય ઘણાં પીળક જોવા

મખ્યાં પીળકના આ માળાથી આશરે ૨૭ મી.ના અંતરે અન્ય એક દેશી બાવળ ઉપર કાળિયા કોશીનો માળો જોયો. માળામાં પક્ષી બેઠેલું હતું. થોડી વાર બાદ તે ઉડ્યું તેથી માળામાંનાં બે બચ્ચાં જોઈ શકાયા.

આમ, બે જગ્યાએ કાળિયા કોશી તથા પીળકને સાથે (નજીક) માળો બનાવતા જોયા. પોતાના માળાની આસપાસ ફરકતા કાગડા, કલકલિયા વગેરે પક્ષીઓથી છંદ્ઘાઈ હતા, તથા તેમને દૂર ભગડતા કાળિયા કોશીને પીળકની અવરજવરથી કંઈ ફરક પડતો નહીં હોય, તેમ લાગ્યું.

કાળિયા કોશીના બનાવેલ માળા ઉપરાંત અન્ય પક્ષીઓના માળા પણ નિહાળ્યા, જે આ જ વૃક્ષ ઉપર હતા. વૃક્ષની ટોચ ઉપર કાગડાએ બનાવેલ જૂનો માળો હતો. તેમાં બે કાબરોને (Common Myna) દાખલ થતા જોઈ. આ માળો જૂનો તથા ખાલી હતો, જેનો કાબરે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

નીચેની એક ડાળ ઉપર હોલા (Ring Dove) નો માળો જોયો. તે કોશીના માળાથી ૨૦મી.ના અંતરે હતો. તેમાં એક હોલો બેઠેલો હતો.

નજીકની બીજી ડાળ ઉપર લોટણ હોલા (Red Turtle Dove) નો માળો જોયો. એક પક્ષી માળામાં હતું જગ્યારે બીજું, માળા નજીક ડાળ ઉપર બેઠેલું નિહાળ્યું.

આ જ વૃક્ષની એક સૌથી નીચેની ડાળી પાડીને સમાંતર હતી અને પાણીથી આશરે ત્રણેક મી.ની ઊંચાઈએ હતી. આ ડાળી ઉપર બુલબુલે (Redvented Bulbul) પોતાનો માળો બનાવ્યો હતો. માળામાં એક પુખ પક્ષી બેઠેલું હતું. થોડી વાર બાદ બુલબુલ માળામાંથી ઉડ્યું. તેના ગયા બાદ, એક ગિરનારી કાગડો (Jungle Crow) તે ડાળ ઉપર આવી ચંચ્ચો અને માળામાંનાં ઈડાં ઓરોગવાના હેતુસર માળાની એકદમ નજીક ગયો. કાગડાની દાનત પામી જતા ઉપર બેઠેલા કાળિયા કોશીએ તેને દૂર ભગડ્યો. કાળિયા કોશીને બીજા પક્ષીના માળાનું રક્ષણ કરતા પહેલી વાર જોયો.

નજીકના બીજા એક દેશી બાવળની ટોચ ઉપર કાળી કંકણસાર (Black Ibis) નો માળો જોયો. માળામાં બે પક્ષીઓ હતાં. માળો ઘણો ઊંચાઈએ હોવાથી માળામાંનાં ઈડાં જોઈ શકાયા નહીં.

લાંબવેલના જમણી તરફના નાના તળાવ ઉપર ઉગેલા દેશી બાવળ ઉપર સુગરી (Baya) ના તેર જેટલા માળા જોયા. આ પૈકી સાત માળા સંપૂર્ણ હતા, જગ્યારે બાકીના અધૂરા હતા. દેશી બાવળ તળાવની કંઈ હોવાથી નીચે પાડી હતું. માળા ગત વર્ષના હોય તેમ લાગતું હતું. માળાની આસપાસ પંદરથી વીસ જેટલી સુગરી દેખાઈ. તેઓ પ્રજનન પોણાકમાં શોભતી હતી. કેટલીક સુગરીઓ આ માળાનાં ઘાસને અલગ પાડવાનો પ્રયાસ કરતી હતી. દેશી બાવળ ઉપર સુગરી સ્થિવાય ઘણાં વનવેલાં (Jungle Babbler) હતાં. પોતાની પ્રવૃત્તિમાં મગન એવાં આ પક્ષીઓએ અચાનક શોરબકોર શરૂ કર્યો. ધ્યાનથી જોતા ત્યાં બાવળ ઉપર ધામણ (Rat Snake) દેખાઈ. પક્ષીઓ મોટા અવાજે સાપનો ભય દર્શાવતાં હતાં. સાંભળી ન શકતી ધામણે ધીમે, મક્કમપણે સુગરીના જૂના માળાઓ તરફ પ્રયાણ ચાલું રાખ્યું. એક માળાને વીટળાઈને, તેની બખોલની આસપાસ તથા અંદરની તરફ નિરીક્ષણ કર્યું. અંદર બચ્ચાં કે ઈડાં નહીં હોવાથી તે બીજા માળાઓ તરફ વળી અને ત્યાં પણ ખોરાક નહીં મળતા તે નજીકના બાવળ ઉપર ખસી ગઈ. અહીં માળામાંનાં ઈડાં તથા બચ્ચાને સાપથી ભય છે.

સુગરીના માળાથી અડધા ડિ.મી.ના અંતરે ધાબાજરિયા (Typha) ઉપર વીસ જેટલી પાણસુગરી (Blackthroated WeaverBird) જોઈ. તેઓ પણ પ્રજનન પોણાકમાં હતી. આ પૈકી બે પાણસુગરીઓને ધાબાજરિયાનાં પાણને વીટળી માળો કરતાં જોઈ. માળો બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી.

એક દેશી બાવળની ડાળ ઉપર અઠિયાવીસ જેટલાં તારપૂંછ તારોડિયા (Wiretailed Swallow) જોયા. આ પૈકી ત્રણ પુખ હતા, જગ્યારે બાકીનાં બચ્ચાં હતાં. નજીક જ એક નર શક્કરખોરા (Purple Sunbird) ને જોયો. તે તરોડિયાની લાંબી પૂંછડી મેંચી તેમને ભગડવાનો પ્રયત્ન કરતો હતો! આસપાસ શક્કરખોરાનો માળો દેખાયો નહીં.

લાંબવેલ તળાવમાં પક્ષીગણતરી

તા. ૧૪-૬-૨૦૦૨ના રોજ લાંબવેલ તળાવની મુલાકાત દરમિયાન થયેલ પક્ષીગણતરી આ મુજબ છે. નડી

બગલો (Purple Heron) ૮, કાઢી બગલી (Pond Heron) -૧૮, હોર બગલા (Cattle Egret) ૩૦, નાનો બગલો (Little Egret) ૮૮, પીળીચાંચ ફોક (Painted stork) ૧૫, ઘોળી કંકણસાર (White Ibis) ૫૦, કાળી કંકણસાર (Black Ibis) ૧૬, નાની કંકણસાર (Glossy Ibis) ૫૨૨, ચમચા (Spoonbill) ૭૦, મોટા હંજ (Greater Flamingo) ૪૬૮, નાની સિસોટી બતક (Lesser Whistling Teal) ૨૦૦૦, નકટો (Comb Duck) ૨૪૦, સારસ (Sarus Cranes) ૨, જલમુરધો (Watercock) ૩, નીલ જલમુરધો (Purple Moorhen) ૩૬૩, શેતપંખ જલમાંજર (Pheasant-tailed Jacana) ૧૨૨, રિટોડી (Redwattled Lapwing) ૮૬, કાળો જલમાંજર (Bronzwinged Jacana) ૨, જલમુરધી (Indian moorhen) ૩, ગજાંઓ (Blackwinged Stilt) ૬૮, કાશ્મીરી વાબગલી (Whiskered Tern) ૧, કલકલિયો (Whitebreasted Kingfisher) ૧, તારાપૂંછ તરેડિયા (Wiretailed Swallow) ૨૫.

તળાવમાં અન્ય ઘોળી કંકણસારો પૈકી એક ધ્યાન દોરે તેવી હતી. આ કંકણસાર તળાવમાં ઊગલી વનસ્પતિ ખસેડતી આગળ વધતી હતી તથા ખોરાક શોધતી હતી. તેની પાછળ એક હોરબગલો (Cattle Egret) તેને અનુસરતો હતો, અને કંકણસારની હીલચાલથી ઊડતી જીવાતનો લાભ ઉઠાવતો હતો. તળાવમાં કેટલીક બેંસો પણ હતી, જે ઉગેલ પાનકુંઠી (Water Hyacinth) આરોગતી હતી. પોતાને અનુસરતા હોરબગલાને ભગાડવાનો કંકણસારે બે-ત્રણ વખત પ્રયત્ન કર્યો, પરંતુ બગલો તેની પાછળ જ ચાલતો હતો. સામાન્ય રીતે જેતરોમાં હોર તથા 'ડ્રેક્ટર' ને અનુસરતા તથા ખોરાક મેળવતા હોરબગલાને, તળાવમાં લેંસની ઢાજરી હોવા છતાં, ઘોળી કંકણસારને અનુસરતો જોવાનો મારો પ્રથમ અનુભવ હતો.

તળાવમાં ખોરાક માટે ફરતી ઘણી નીલ જલમુરધી (Purple Moorhen) ઓ પૈકી કેટલીક બચ્ચાં સાથે દેખાઈ. નીલ જલમુરધીનાં બચ્ચાં પુખ પક્ષીઓ કરતાં તદ્દન જુદાં તરી આવતાં હતાં. રંગે કાળા એવાં આ પક્ષીઓના પગ આછા ગુલાબી હતા. કેટલીક નીલ જલમુરધીઓ માળામાં બેઠેલી દેખાઈ. આ માળા પાછળિની સપાટી પર હતા, તથા પાનકુંઠીનાં સૂકા પાનના બનેલા હતા.



લાકડાના 'નેસ્ટબોક્સ'માં ચીભરીનો માળો

આણંદના 'ગુજરાત એશ્રીકલ્યર યુનિવર્સિટી', 'બાયોકંટ્રોલ લોબોરેટરી'ની અગાસી ઉપર જાળીને અડીને એક લાકડાનું પક્ષીધર (Nestbox) લગાડેલ છે. તા. ૨૭-૩-૨૦૦૨ના રોજ ચીભરી (Spotted Owllet)ને તેમાં નિવાસ કરતા જોઈ. નિરીક્ષણ કરતાં, તેમાં ત્રણ ઈંડા જોવા મળ્યા. આ પહેલા આ બોક્સમાં કાબરે માળો બનાવ્યો હતો, તેથી તેના માળાનો કચરો બોક્સમાં જેમનો તેમ પડ્યો હતો અને ચીભરીએ તેની ઉપર ઈંડા મુક્યા હતા. ત્યાર બાદ, દર બે દિવસે સવારે (નવ વાર્ષે) અને સાંજે (ચાર વાર્યાની આસપાસ) પક્ષી તથા માળાનું નિરીક્ષણ શરૂ કર્યું. આ દરમિયાન પુખ પક્ષી માળામાં ઈંડા સેવતું જોયું. ઈંડા સેવતી વખતે તે ઘણું સચેત રહેતું. જ્યારે પણ કોઈ વક્તિ માળાની આસપાસ ફરકતી કે આ પક્ષી તરત જ માળામાંથી ઊડી જઈ સામેના ગોરસ આમલીના જાડ ઉપર જઈ બેસતું અને શોરબકોર કરી મૂકૃતું. ક્યારેક જાડ ઉપર બે ચીભરીઓ દેખાતી. તેમાંથી એક સહેજ નાની હતી. એકવીસ દિવસ સુધી ઈંડા સેવવાનું કામ ચાલ્યું. તા. ૧૬-૪-૦૨ના રોજ બે ઈંડામાંથી નીકળેલ બચ્ચાં જોવા મળ્યાં જ્યારે નીજુ ઈંડું એમ જ હતું, જેમાંથી બચ્ચાંનું નિકળ્યું નહીં. આ ઈંડાને સહેજ તિરાડ પડી ગઈ હતી. ઈંડું ખોલીને જોતા તેમાં સંપૂર્ણ વિકસિત ગર્ભ મળ્યો. આ ઈંડાને ગર્ભવિકાસના અંતિમ તબક્કા દરમિયાન ઈજા થઈ દશે, તેમ લાગ્યું. અન્ય બે ઈંડામાંથી નીકળેલાં બચ્ચાની આંખો બંધ હતી તથા તેમના શરીર ઉપર સફેદ downy પીંછાં હતાં. તા. ૧૮-૪-૦૨ના રોજ માળામાં એક જ બચ્ચાં હતું જ્યારે બીજું બચ્ચાં દેખાયું નહીં. બચ્ચાને માળાની બદાર કાઢી અવલોકન કર્યું તો તેના શરીર ઉપર ચોટેલી અનેક સફેદ ઈયણો (Maggots) દેખાઈ. ચીપિયાની મદદથી સાવધાનીપૂર્વક ઈયણો દૂર કરી. માળામાં રહી ગયેલ જૂનો કચરો દૂર કરી. માળો સાફ કર્યો અને બચ્ચાને ફરી માળામાં મૂક્યું. (બીજું બચ્ચાં કદાચ આ ઈયણોને લાધે મૃત્યુ પાણ્યું હશે.) ત્યાર બાદ, બચ્ચાના શરીર ઉપર ઈયણ દેખાઈ નહીં. તા. ૨૮-૪-૦૨ના સુધી માળાનું નિરીક્ષણ ચાલ્યું. પુખ પક્ષી બચ્ચાને જે ખોરાક ખવડાવતું, તેમાંનું વધી ગયેલું કેટલુક માળામાં પડી રહેતું. આ ખોરાક એકત્ર

કરી માળામાંથી દૂર કર્યો. પુખ પક્ષી બચ્ચાને કીટકો, દેડકા, સાપ, ઉદર વગેરે ખવડાવતું. આ ઉપરાંત, ખોરાકમાંથી ચામાચીડિયાના શરીરનાં કેટલાક અંગો પડ્યા મળ્યાં.

તા. ૧૩-૫-૦૨૦૨ના રોજ બચ્ચાને સૌ પ્રથમ વાર માળાની બહાર ગોરસ આંબલીની ડાળ પર બેઠેલું જોયું. આ પક્ષી પાંખો ફક્ફડાવી ઊડવાનો પ્રયત્ન કરતું હતું. નજીક જ પુખ પક્ષી પડ્યા હતું. આ બંને પક્ષીઓ સાંજ સુધી બેઠેલાં હતાં. બીજા દિવસથી બચ્ચું કે પુખ પક્ષી કોઈ દેખાયા નહીં.

ચીભરીએ ગયા વર્ષે પડ્યા આ બોક્સમાં બચ્ચાં (ઉછેર્યા હતાં).

અનિકા એસ. જીધવ

ગુજ. એગ્રોકલ્ચર યુનિ., બાયો કંદ્રોલ લેબ., આંધ્ર ૭૮૮૧૧૦.



ચકલીનો માળો

‘વિહંગ’નો ગ્રીઝ-૨૦૦૨નો અંક મળ્યો. એમાં ‘પ્રોજેક્ટ બસ્ટર્ડ’નો લેખ વાંચી ઘડી માહિતી ગ્રાપ થઈ. હું ધોરણ રૂમાં અભ્યાસ કરું છું ને પક્ષીપ્રેમી છું.

મારા ઘરની બારીના છજા ઉપર મેં પોચા લાકડાની એક પેટી / ખોખું મજબૂત રીતે બાંધીને લટકાવેલ છે. આ ખોખું મોટું છે. તેમાં છ ખાનાં બનાવ્યા છે. આ ખાનાંમાં ચકલીઓ માળા બાંધી શકે તે માટે જુદી જુદી દિશામાં, પરતુ પ્રત્યેક ખાનામાં પ્રવેશવા માટે દોઢ્યી બે ઈચ્છાનું ગોળાકાર એક-એક પ્રવેશદ્વાર પડ્યા બનાવ્યું છે. પરતુ આ આખાય ખોખા પર ફક્ત એક જ ચકલા-ચકલીએ કબજો જમાવી રાખેલ છે. તેઓ અન્ય ચકલીઓને કે પક્ષીઓને આ ખોખામાં માળો બાંધવા દેતાં નથી. તો મારો પ્રશ્ન છે કે, મેં ટી.વી. (ડિસ્કવરી ચેનલ) પર જોયા મુજબ કેટલીક જાતનાં પક્ષીઓ આ પ્રમાણેના ખાનાવાળા નેસ્ટબોક્સમાં, આનંદથી સમૂહમાં, જુદાંજુદાં ખાનાંમાં, એક જ જગ્યાએ રહેતાં દોય છે. તો મારે ત્યાં આમ કેમ બન્યું? શું ચકલીઓ સમૂહમાં કે વસાહતમાં રહેતી નથી? મારો ઈરાદો એક જ જગ્યાએ ઘણી બધી ચકલીઓને ‘નેસ્ટબોક્સ’માં આશ્રય આપવાનો હતો. આ ખોખા પર કબજો જમાવેલ ચકલીના જોડાએ બે વાર એપ્રિલ-૨૦૦૨ અને ત્યાર બાદ, જૂન - ૨૦૦૨ની શરૂઆતમાં ત્રણત્રણ ઈડાં મૂક્યાં હતાં. તેમાંથી બસે વાર એક-એક ઈંદું નાશ પામ્યું અને બબ્લે બચ્ચાં (કુલ

ચાર) ઉછેરીને મોટાં કર્યા, જેનું મેં નિરીક્ષણ કર્યું હતું. કેટલાક સમયથી એક કાબરનું જોડું દરરોજ વહેલી સવારે આ માળા પર હુમલો કરવા આવે છે અને માળો વેર-વિભેર કરવા પ્રયત્ન કરે છે. બચ્ચાને પડ્યા મારી નાંખવા પ્રયત્ન કરે છે. તો મને પ્રશ્ન થાય છે કે કાબરની ચકલી પ્રત્યેની આવી વર્તાણુંક શા માટે હશે? કાબર-ચકલીને પરસ્પર જન્મજાત દુશ્મની હોય છે કે શું?

(ચકલીઓ રાતવાસો સમૂહમાં કરે છે એ ખર્ચ, પડ્યા માળા તો અલગ અલગ કરે છે અને પોતાની છદમાં બીજી ચકલીઓને માળા કરવા દેતી નથી. તમારી માળાપેટીનો જ્યાં સુધી એક ચકલી પ્રજનન માટે ઉપયોગ કરશે ત્યાં સુધી બીજી ચકલીઓ કે પંખીઓને તે માળાપેટી પર આવવા નહીં દે.

બગલા, ઢોંક, કાળિયા, સુગરી વગેરે સમૂહમાં માળા કરે છે. આજુબાજુનાં વૃક્ષો પર તેમના માળા નજીક નજીક હોય છે. ‘ડિસ્કવરી ચેનલ’માં તમે આવા સામૂહિક માળા કરનાર પંખીઓ જોયા હશે.

દ્યેડ, દેવચકલીની જેમ કાબર બખોલમાં માળા કરનાર પક્ષીછે. કુરટી ખોલોના અભાવે તેઓ માળાપેટીઓનો ઉપયોગ કરે છે. કોઈ કોઈ પંખી બીજા પંખીના માળા ક્યારેક તોડે ફોડે છે. કાબરને તમારી માળા પેટીમાં પ્રજનન કરતું છે એટલે તે ચકલીયુગલને હેરાન કરીને તેમાંથી હંડી કાઢવા પ્રયત્ન કરે છે. બાકી ચકલી-કાબરને જન્મજાત દુશ્મની નથી.

લાકડાની પેટીનો તમે માળાપેટી કરવામાં ઉપયોગ કર્યો તેથી ખુશી થાઉં છું. ઈચ્છાં છું કે, તમારી માફક અન્ય મિત્રો આવી સાઠી વસ્તુઓનો માળા પેટી કરવામાં ઉપયોગ કરે, તો ખોલોલોમાં માળો કરનાર કેટલાં પંખીઓ તેનો લાભ લેશે. તમે એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છો.

રથિન એ. ધોળટિયા

બી-૨૦૧, રાધે એપાર્ટ., ગાયની સોસાયટી સામે, નવયુગ કોલેજ
પાછળ, નવો રાંદર રોડ, સુરત ૩૮૪૦૦૮



મત્સ્યભોજી બતક (SMEW, Mergus albellus) અંગેનો અહેવાલ

તા. ૧૮-૨-૦૨૦૨ના રોજ વડોદરાના પક્ષીચાહક મિત્ર સિધ્ધાર્થ અમીન સાથે વડોદરાથી આશરે રૂપ ડિ.મી.

દુર આવેલ હરિપુરા (તા. જરોદ) ગામના તળાવે પક્ષીદર્શન માટે સાંજે નીકળ્યો હતો. હરિપુરા તેમજ તેની આજુબાજુ આવેલ વડદા અને ધનોરાનું તળાવ પણ પક્ષીનિરીક્ષણ માટે આદર્શ સ્થળ છે. હરિપુરાના તળાવમાં અમે લગભગ ૩૮ જેટલી ભગવી સૂરખાબ (Brahminy Duck), ૪ નક્ટા (Nukta), ૧૩ સીંગપર (Pintail), ૮ રાખોડી કારચિયા (Common Pochard) અને ૪ જેટલી નાની મુરથાબી (Common Teal) જોઈ. અમારા આશ્વર્ય વચ્ચે અમને આ બધી બતકે સાથે મત્ત્યભોજી બતક (SMEW) ની એક માદા જોવા મળી. અંધારું થતાં સુધી, લગભગ એક કલાક સુધી તેની પ્રવૃત્તિને નીરખવાનો મોકો મળ્યો, તેથી તેની પાકી ઓળખ પણ શક્ય બની. તે જ્યારે પાણીની બહાર આવીને બેઠી અને પીંછા સાફ કરવા લાગી ત્યારે તેનું સંપૂર્ણ શરીર નિહાળવાની તક મળી, તેથી અને પક્ષીદર્શન અંગેના પુસ્તકોની મદદથી, સ્થળ પર જ તેની પાકી ઓળખ શક્ય બની. મત્ત્યભોજી બતક અંગેના ભૂતકાળના કોઈ અહેવાલ 'વિહંગ' આપી શકે?

('Birds of Gujarat' Salim Ali, JBNHS Page 391, No. 542, 1954, mentions Butler {SF Vol. IV Page 31, 1876} saw it occasionally on some tanks in northern Gujarat. He described it as very uncommon and extremely shy. It has not been recorded from Kutch & Saurashtra : Courtesy, Dr. B.M. Parasharya)

રોહિત વાસ

૧૮૦, અજાત સોસાપટી, ઉમા સોસાપટી પાસે, અલકાપુરી, વડોદરા

સુરત જિલ્લામાં ચિલોત્રો

તા. ૨-૪-૨૦૦૨ના રોજ હું, માંડવી, ઉત્તર રેઝના RFO શ્રી ડી. જે. રાજપૂત, દક્ષિણ રેઝના RFO શ્રી એસ. જી. મંદોડ તેમજ ACF શ્રી વી. જી. ચૌધરી, સાંજે ૫-૦૦ કલાકે, માંડવીથી ઉત્તરપાડા રોડ પર આવેલ માંડવી, ઉત્તર રેઝના જંગલ વિસ્તારમાં આવેલા સરસી વનમાં ગયા હતા. સાંજે ૬-૦૦ વાગ્યાનો સમય હતો. અચાનક મોટા ઝડપ ઉપર અવાજ સંભળાયો. મારી નજર ગઈ. જોયું તો ચિલોત્રો (Grey Hornbill)! મારાથી મોટા સાદે બોલી દેવાયું, "અરે! આતો Hornbill!" મારા સાથી મિત્રોની

નજર પડ્યા ગઈ. અમારી પાસે 21x 8 નું બાયનોક્યુલર હતું. લગભગ અડ્યો કલાક સુધી અમોંગે એની પ્રેમકીડા જોઈ. કુલ ૪ ચિલોત્રો હતા. ખૂબ જ મજા આવી. અમારા વિસ્તારમાં પ્રથમ વખત જ આ પક્ષી જોવા મળ્યું. ખરેખર સુંદર અને અદ્ભુત હતું. ફરી રીતે તારીખે હું અને મારા મિત્ર કુશલભાઈ શાહ ફરી વખત સરસી વનમાં ગયા. તે દિવસે પણ સવારે ૧૦-૦૦ કલાકે એક ચિલોત્રો એ જ જગ્યાએ જોયો.

જયંત ભોજવાલા

જત્તીવાડ, ધોરીમાર્ગ, માંડવી, જી.સુરત



તલિયા ટપુસ્સિયાના માળા

તા. ૮-૪-૨૦૦૨ના રોજ મારા બેન, બનેવી ગામથી આવેલાં એટલે ફરવા જવાનું નક્કી કર્યું. બને ભાણિયા, આશિષ અને હિદેશને પણ મારાથી પક્ષીઓનો શોખ જાગ્યો હોવાથી ફરવાનો અને પક્ષીનિરીક્ષણનો કાર્યક્રમ ગોડલ્યો. અમે સવારે સુરતથી દ વાગ્યે નીકળ્યા. વલસાડ પાસે પારનેરા હુંગર રણીયામણો છે. આજુબાજુ જંગલભાતા નરકથી ઝડપ વાવાં હોવાથી સારું જંગલ બની ગયું છે.

લગભગ ૮ વાગ્યે બીલીમોરા પહોંચ્યાં. ત્યાં મહાદેવનું મંદિર હોવાથી બધાં દર્શન કરવા અંદર દાખલ થયા. સરસ મંદિર હે. આજુબાજુ બગીચો છે. બગીચા ફરતે જીણી જેવાં પાન ધારવતાં ઘાટા, લગભગ પાંચેક ફૂટ ઊચા નરાંઓ છોડ, હતાં. તેમાં એક નાનું ચકલી જેણું પક્ષી, મારા ભાણિયાઓ પ્રથમ વખત જોતા હોવાથી દોડતા આવ્યા, "મામા નવું કોઝી કલરનું ટપકાવણું પક્ષી છે." મને અંદાજ આવી ગયો. અમે એકદમ નજીક ગયા. ફોટો પાડ્યો છિતાં બેહું હતું. આટલું નજીક હું પણ પ્રથમ વાર જોતો હતો, લગભગ ૮ ફૂટ નજીક. ત્યાં જ મારા મોટાભાઈનું ઘણ ગણ્યું ગોળ દડા જેવા વૃક્ષની અંદર તલિયા ટપુસ્સિયા (Spotted Munia) નો માળો હતો. પછી તો શરૂ થઈ માળાની હારમાળા. જેટલાં આવાં વૃક્ષો હતાં, દરેકમાં માળો હતો. ઘણાં વૃક્ષોમાં તો બે માળા હતા. લગભગ ૧૬ જેટલા માળા હશે.

ત્યાર બાદ, ત્યાંથી નીકળી પારનેરા પહોંચ્યા, જ્યાં શોભીગી (Iora), નાનો લક્કડખોડ (Pigmy

નિરીક્ષણ નોંધ

Woodpecker), દૂધરાજ (Paradise Flycatcher), અપરંગ (Tickell's Blue Flycatcher), વાંકીચાંચ લેલું (Slatyheaded Scimitar Babbler) વગેરે પક્ષી જોયા.



નાની પાનબગલી (Little Bittern) નું અવલોકન

તા. ૧-૮-૦૨ના રોજ 'નેચર કલબ' માટે અવાજ રેકોર્ડિંગ અર્થે સુરતની આજુબાજુનાં તળાવો ઉપર 'રેકોર્ડિંગ' કરી રહ્યો હતો. મારી સાથે નિર્મલાબેન અને મારા ભાણેજ હિતેશ અને આશ્રિત હતાં. સુરત- ઉમસ રોડ ઉપર ગવિધર તળાવો, સવારે ૮ વાગ્યે અમે પક્ષીનિરીક્ષણ કરી રહ્યાં હતાં. લગભગ ૭ જેટલાં શૈતપંખ જલમાંજર (Pheasant-tailed Jacana) હતાં. તેમાંનાં ચાર શૈતપંખ જલમાંજરની સાથે ચાર-ચાર એટલે કે સોણ જેટલાં બચ્ચાં હતાં. આટલી સંખ્યામાં બચ્ચાં પહેલી વાર જોયા.

ત્યાં જ એક પાનબગલી (Bittern) ઊરીને દક્ષિણાથી ઉત્તર તરફ તળાવમાં ગઈ. હું બોલું ત્યાં જ નિર્મલાબેન બોલી ઉઠ્યા, "આ તો નાની પાનબગલી (Little Bittern)!" અલપ અલપ જોઈ, પણ ૧૦ મિનિટ બાદ ફરી ઓ ઉત્તરથી દક્ષિણ તળાવમાં જતી જોઈ, ત્યારે તેમાં જરા પણ શંકા ન રહે, એટલી સરસ જોઈ. ગુજરાતની પક્ષીનોંધમાં આનો ક્યાંય ઉલ્લેખ નથી. (નાની પાનબગલીનું વર્ણન સ્થળ પર જ લખી લેવું જરૂરી હતું. અથવા તેની કઈ વિશિષ્ટ નિશાનીઓથી તેને ઓળખી તે અહીં આપવું જોઈતું હતું. ગુજરાતમાં અગાઉ નોંધાયેલ ન હોય તેવું પંખી જોવામાં આવે ત્યારે આ બહુ જરૂરી અને મહત્વનું છે. - લા.) થોડાં દિવસ પહેલા, 'નેચર કલબ, સુરત' માટે રતનમહલ ગયો હતો ત્યારે ત્યાં Nilgiri Flycatcher જોયું હતું અને અવાજ પણ રેકોર્ડ કર્યો હતો. એ પહેલા કોશી કોયલ (Drongo Cuckoo) ની પ્રથમ નોંધ તથા અવાજ રેકોર્ડ કર્યો હતો. આ બધું શું સૂચયે છે? વાતાવરણમાં ફેરફાર? અગાઉ પક્ષીનિરીક્ષકો ઓછા હતા? કે જંગલો કપાતાં જતાં હોવાથી પક્ષીઓનું સ્થળાંતર? (આ ત્રણેય બાબત ઢોઈ શકે. - લા.)



નવરંગ (Indian Pitta) સાથે ૧૦ દિવસ એક પહેલી સવારે કોઈ ભાઈ રસ્તે સવારમાં

નિકળ્યા હશે. તેમને એક કાબર જેવું, રંગીન પક્ષી મણું. તે હતું નવરંગ. તેઓએ 'નેચર કલબ'ના સભ્યોનો સંપર્ક કરી તે પક્ષી, દર્શન દેસાઈને આપું. ત્યાંથી હું લાગ્યો. તે ન હતું ઊરી શકતું. ખાવાનું પણ બંધ કરેલ. ત્રણ ચાર દિવસમાં નબળું પડી ગયું. સુરતમાં દર વર્ષ જ્યાં નવરંગ એકલ દોકલ આવે છે, ત્યાં લઈ જઈ બહાર મૂક્યું, પણ થોડાં ડગલાં ચાલીને બેસી ગયું. અમે બે એક કલાક બેઠા પણ તેનું કોઈ છલનચલન ન હતું. મેં વિચાર્ય, આમને આમ રહેશે તો કાગડા કે અન્ય કોઈ પક્ષી મારી નાખશે. ઘરે લઈ જઈ શાકબાજીવાળા પાસેથી ફ્લાવર, કોબીજમાંથી નીકળતી લીલી ઈયાં લાગ્યો. બે ચાંચ ખોલીને ધરાર ખવડાવી. અરીસા લઈ જતો, પણ પોતાનું પ્રતિબિંબ જોવા છતાં કોઈ અસર થઈ નહીં. નવરંગનો મેં 'રેકોર્ડિંગ' કરેલ અવાજ સંભાળાવ્યો, પણ કંઈ જ અસર નહિ. બહેરું હશે? આંધળું હશે? એવો વિચાર આવ્યો. પછી થયું, 'શોક' લાગ્યો હશે. બે દિવસ ઈયાં ખવડાવ્યા પછી શક્તિ આવી. ધરમાં ધીરે ધીરે કૂદતું કૂદતું ફરવા લાગ્યું. નાના ટેબલ પર બેસાડ્યું તો કૂદીને નીચે! એનો અર્થ એ થયો, આંધળું નથી શોક જ લાગ્યો છે. ધીરે ધીરે તંહુરસ્ત થવા લાગ્યું. ત્યાં બે ચાર દિવસ પછી 'નેચર કલબ'ના નિર્મલા મેડિમ, જે પક્ષીઓની સારવાર કરે છે, તેમને આપું. તેઓએ બે દિવસ રાખ્યું, પછી એક જગ્યાએ છોડ્યું. ત્યાં તેના ઉપર કાબરોએ હુમલો કર્યો. નવરંગે સામે હુમલો કર્યો. પછી બધાં જ દૂર જઈ જણાવા લાગ્યાં, મિત્રો બની ગયા અને સાથે ઊરી ગયા.

બરુચ અંકલેશ્વર વચ્ચે ધોરીમાર્ગ પર મારી નજર સામે એક ચાતક (Piedcrested Cuckoo) ખટારા સાથે અથડાયું. મેં ગાડી ઊભી રાખી ને લઈ લીધું. તેનો પગ તૂટી ગયો હતો. થોડી વારમાં છ થી સાત ચાતક આવી ગયા. બચવાની આશા જગતી નહોતી. નિર્મલા મેડમને આપું. ચાર દિવસની સારવાર પછી એક દિવસ ધરમાંથી ઊરી ગયું.



સુરતમાં (Water-Cock) જલમુરધો

તારીખ

નં માદા

૦૨-૬-૨૦૦૦ દ.ગુ.યુનિ.કેમ્પસ ૨ ૧

૧૧-૬-૨૦૦૦ કામેરજ ૨ -

૦૮-૬-૨૦૦૦ દ.ગુ.યુનિ.કેમ્પસ ૨ -

નિર્જીવણ જોડ

૦૨ - ૬ - ૨૦૦૧ ગવયર તળાવ	૧	-
૩૦ - ૭ - ૨૦૦૧ કામરેજ	૨	૧
૩૦ - ૭ - ૨૦૦૨ દ.ગુ.યુનિ.કેમ્પસ	૨	-
૦૪ - ૭ - ૨૦૦૨ કામરેજ	૭	-

મુક્ત શાખા

સારસ, ૧૦૧, ધરતી એપાર્ટ., ચંદ્રન પાર્ક, સિટી લાઈટ રોડ, સુરત



ભાવનગર અને આસપાસ

+ તા. ૨-૭-૦૨ના રોજ અમારી સંસ્થાના પ્રાણીશાખાના વિદ્યાર્થીઓની ટીમને લઈને વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગયા હતાં. ત્યાં સારસની એક જોડી જોઈ અને ૧૬ ખડમોર (Lesser Florican) જોયાં.

+ તા. ૨૪-૮-૦૨ના રોજ શહેરની વચ્ચે આવેલ પીલ ગાડનમાં પીળીચાંચ ઢોક (Painted Stork) તેની માળા વસાહતની જગ્યાએ જોવા મળ્યા. માળા બાંધવાની શરૂઆત હજુ થઈ ન હતી. (શ્રેષ્ઠિક શાહની નોંધ)

+ તા. ૨૭-૮-૦૨ના રોજ હું અને ડો. પારાશર્ય ભાલમાં આવેલી નિરમા કંપનીના મીઠાનાં અગરો અને આસપાસના વિસ્તારો જોવા ગયા હતા, જેમાં અંદાજે ૮૦૦૦ જેટલાં નાનાં દંજ (Lesser Flamingo) અને ૧૦૦૦ જેટલાં મોટાં દંજ (Greater Flamingo) જોવા મળ્યાં.

+ તા. ૧-૮-૦૨ના રોજ હું અને શ્રી હરભદ્રસિંહ સરવૈયા વેળાવદર ગયા હતા. ત્યાં જતાં રસ્તામાં સનેસ ગામ પાસે, આ વર્ષમાં પહેલી વખત ૩૦૦ જેટલાં કરકરા (Demoiselle Crane) જોયા. ઉપરાંત, વેળાવદર રા. ૩.ની તલાવીમાં ૩૫૦ મોટાં દંજ (Greater Flamingo) પો ગયણા (Shoveller) અને અન્ય પક્ષીઓ જોયા.

+ તા. ૧૦-૮-૦૨ ખોખરાના હુંગરોમાં એક નાનકડા તેમ પાસે એક તુરમ્ભી (Redheaded Merlin) જોઈ.

+ તા. ૨૮-૮-૦૨ના રોજ ભાવનગરથી ૩૦ કિ.મી. દૂર કૂડાના દરિયાડિનારે મે અને હરભદ્રસિંહ સરવૈયાએ સવારે ૧૦ વાગે, દિશકારી પક્ષીઓ ઊડતાં જોયા, જેમાં બે ધોળવા ગુમ્ભસ (Tawny Eagle), અને એક ખેરો

(Egyptian Vulture) હતાં. અન્ય ત્રણ ગરૂડ ઓળખી ન શકાયા.

+ તા. ૬-૧૦-૦૨ના રોજ અમારી સંસ્થાના પ્રાણીશાખાના વિદ્યાર્થીઓ અને શ્રી હરભદ્રસિંહ સરવૈયા સાથે વેળાવદર ગયો હતો. ત્યાં અંદાજે ૨૦૦૦ જેટલી પણ્ઠાઈ (Harrier) જોવા મળ્યી.

+ આ વર્ષ (૨૦૦૨) સારા ચોમાસાને કારણે અહીંના ‘વિકોરિયા પાર્ક’ આરક્ષિત જંગલમાં આવેલું કૃષ્ણકુંજ તળાવ સાત વર્ષ ભરાયું. તેમાં વચ્ચે આવેલાં બાવળનાં વૃક્ષો ઉપર ઓગણ માસથી જ નાના કાજિયા (Little Cormorant), રાત બગલા (Night Heron) અને સફેદ કંકણસાર (White Ibis) ની માળાવસાહતો થઈ છે. બાવળની ગીયતાને કારણે માળાની સંખ્યા ગણવી મુશ્કેલ છે. પક્ષીઓની આવનજ્ઞવન પરથી લાગે છે કે માળાની સંખ્યા ઘણી સારી છે.

ઇન્ડ ગફવી

લોટ-૨૨૦૦, અંકુર સૈલેન્સીયરી, ભાવનગર-૩૬૪૦૦૧



‘બરડામાં પક્ષીદર્શન’

સૌરાષ્ટ્રમાં ઊરનાર પણી જો વનસ્પતિસૂચિથી સમૃદ્ધ કોઈ પર્વત હોય તો તે બરડો હુંગર. તે આર્યુરેન્ટિક વનસ્પતિથી ભરપૂર છે. તેમાં પણ છેલ્લાં ૮-૧૦ વર્ષથી લાડાં કાપવાનું તેમજ દારુ ગાળવાનું ઘણું ખરું બંધ થયેલ છે. અંદર ઘણા ચેક તેમ બનાવવામાં આવેલ છે, એટલે ઘણી ખરી જગ્યાએ પાણી ભરેલાં દેખાય છે. વહેલી સવારે ૬-૦૦ વાગે ખંભાળા તેમ પહોંચ્યાં. આસપાસનાં વૃક્ષો ઉપરથી મોર તથા અન્ય પક્ષીઓ પાણી પાસે જોયાં. ત્યાં દંજ, પીળીચાંચ ઢોક (Painted Stork) તથા કાજિયા (Cormorant) જોયાં.

ખંભાળથી આગળ અમારો ગ્રાવાસ સાત-વિરાની જગ્યાએ પહોંચ્યો. માર્ગમાં અમે ઘણી જતનાં પક્ષીઓ જોયા. તેમાં જલમાંજર (Jacana) (કયો? સં.), બુલબુલ (Bulbul) (કયું? સં.), કલકલિયો (Kingfisher) (કયો? સં.), ઘંટીટાંકણો (Hoopoe), વૈયાં (Rosy

Pastor), એરખણી (Treepie), સફેદ કંકડાસાર (White Ibis), નાના બગલા (Little Egret), કબૂત બગલો (Grey Heron), ટીલિપાળી બતક (Spotbill), મોર (Pea Fowl), દેવચકલી (Indian Robin), તેતર (Partridge), કંસારો (Copper-smith), બગતડાં (Coots), દિવાળીથોડો (White Wagtail), સુગરી (Weaver bird), દરજુડો (Tailor Bird), કાળોકોશી (Black Drongo), તલિયો ઢોલો (Spotted Dove), થોરિયા લેલા (Common Babbler), સીગપર (Pintail), બટાવડાં (Sandgrouse) વગેરે.

સાત વીરડાથી ડિલેશર તરફ અમારો પ્રવાસ આગળ વધ્યો. ડિલેશરમાં કલકલિયા (ક્યો? -સં.) ને પાણીમાંથી માછલી પકડતો જોવાની મજા આવેલ.

બરડામાં મુખ્ય વનશ્રીમાં ગોરડ, બાવળ, ચુગળ, થોર, આમળા, રાયજા, આંબલી, વડ, પીપળ, લીમડા વગેરે વધારે જોવા મળે છે. લેન્ટેનાનો પણ વધારો થઈ ગયેલ છે. તેનો નાશ કરવો જોઈએ.

દિશોરભાઈ જોશી, જીતેન્દ્રસિંહ સોટા, મહેશ વૈષ્ણવ
“ચન્દ્રસ્મૃતિ”, આશાપુરા સોસાયટી, છાંયા રોડ, પોરંદર



જાંબુઘોડામાં પક્ષીનિરીક્ષણ

આ વર્ષે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જાંબુઘોડા ખાતે પ્રશિક્ષક તરીકે ગયો હતો. ‘કેમ્પ સાઈટ’ કડા તેમની પાસે જ હતી. તેમ વિસ્તારમાં ધ્યાં પક્ષીઓ હતાં. તેમમાં પાણી સારું એવું ભરાયું હતું. જોવા મળેલાં પક્ષીઓની નોંધ મોકલું છું. (તા. ૨૩-૧૨-૦૧ થી ૪-૧-૦૨ સુધી)

બગવી સુરખાબ (Brahminy Duck) ૮૦, ફાટીચાંચ ઢોક (Openbill Stork) ૧૧, ઊલટીચાંચ (Avocet) ૭, ગયણો (Shoveller) ૫, ભગતડાં (Coot) ૨૫, નાની ડુંભકી (Little Grebe) ૨૩, મોરી ચોટીલી બતક (Great-crested Grebe) ૧૦, નાના કાજિયા (Little Cormorant) ૧૫, રાખોડી કારચિયા (Common Pochard) ૩૩, પિયાસડા (Wigeon) ૬૦, સિંગપર (Pintail) ૮, નાની સિસોટી બતક (Lesser Whistling Teal) ૪૩, ધરથરો (Black Redstart) ૨, દૂધરાજ (Paradise Flycatcher) ૧.

૨૩/૨૪-૬-૦૨ના રોજ મારા ત્રણ મિત્રો સાથે રાયપુર જવાનું થયું હતું. મોટરસાયકલ લઈને સવારે રાયપુરથી નીકળી, ૧૦ વાગ્યે, નારુકોટ આશ્રમશાળા પહોંચ્યાં. ત્યાંથી વનકેરી પર ચાલતા આગળ વધ્યા. જંગલમાં પક્ષીઓનો કલબલાટ ખૂબ જ જોરથી આવતો હતો. જાણે સૂરસંગીતની સ્પર્ધા હોય તેમ ચારે બાજુથી વારાફરતી અલગ-અલગ પક્ષીઓના અવાજ આવતા હતા! વનકેરી પર ચાલતી વખતે મારી નજીકના ઝાડ પરથી એક નાનું પક્ષી ઉડીને આગળના વૃક્ષ પર જઈને બેહું, ખાલી એની પૂછદી દેખાતી હતી. વારંવાર ઉપર નીચે થતી હતી. તેની પૂછડીની નીચે લાલભાગ જોતાં, મનમાં થયું, નક્કી આ નવરંગ હોયું જોઈએ. આગળ વધતા શાંતિથી જાડના થડ પાછળ સંતાઈને જોયું તો, આશર્ય સાથે, ખૂબ જ આનંદ થયો! હા! આ જ નવરંગ ! રોહિતભાઈ પાસે તેના વિશે ઘણું સાંભળ્યું હતું. પહેલી વાર જોવા મળ્યું. આશરે સવા કલાક સુધી જોયું. નજીકમાં ઉડી ઉડીને જમીન પર આવતું અને જીવાત લઈને ડાળી પર બેસતું. આ સાથે ત્યાં જોયેલાં અન્ય પક્ષીઓની નોંધ મોકલું છું. નવરંગ (Indian Pitta) ૨, ધરથરો (Black Redstart) ૩, પીળક (Golden Oriole) ૧, બપૈયો (Common Hawk Cuckoo) ૪, ચેતનયના (White-eye) ૧૦, કાળીપીઠ લક્કડખોડ (Blackbacked Woodpecker) ૨, સોનેરીપીઠ લક્કડખોડ (Indian Goldenbacked Woodpecker) ૫.

અનિવ ગોહિલ

એ-૫૭, ભાય્યલક્ષ્મીસો., ગોરવા, આઈ.ડી.આઈ.પાટ્ટણ, વડોદરા-૧૬.



સગાઈ ખાતે પક્ષીનિરીક્ષણ

કેબુ. તા. ૮-૨-૦૨ થી ૧૨-૨-૦૨ સુધીસગાઈ ખાતે કોલેજની શિબિરમાં જવાનું થયું. પાનખરણી જીતુના કારણે સાગાનાં પાન આપા જંગલમાં પથરાઈ ગયાં હતાં. અહીનું જંગલ ખરેખર પક્ષીઓ માટે ખૂબ જ અનુકૂળ છે. અને હા ! ભીમરાજને જોવાનો પહેલો મોકે મળ્યો ! ખૂબ જ સુંદર પક્ષી છે. આ સાથે ત્યાં જોયેલાં પક્ષીઓની યાદી મોકલું છું.

ભીમરાજ (Racket-tailed Drongo) ૨૩, સફેદપેટ કોશી (Whitebellied Drongo) ૧૭, કાળ કોશી

(Black Drongo) ૩૨, શોબિંગ્ (Iora) ૮, સફેદનેણ બુલબુલ (Whitebrowed Bulbul) ૭, તરવરિયા માખીમાર (Greyheaded Flycatcher) ૪, સફેદડોક હોક (Whitenecked Stork) ૨, મોરબાજ (Crested Hawk Eagle) ૧, મધિપો (Honey Buzzard) ૧, વનચીબરી (Jungle Owlet) ૨, પેરખટો (Tree pie) ૭, સફેદનેણ નાચણા (Whitebrowed Faintail Flycatcher) ૭, ટપકિલી નાચણા (Whitespotted Faintail Flycatcher) ૩.



જરૂરી છે એક જૂનું ઝડ !

ઉનાળા અને ચોમાસામાં પક્ષીઓના માળાની ઝતુ ગઈ અને હવે મહેમાન પક્ષીઓની ઝતુ આવી. માળાની ઝતુમાં ખાસ તો એ જોવા મળ્યું કે, એક જૂનું ઝડ, જેમાં એક જ બખોલનો પહેલાં ચીબરી(Owlet) એ ઉપયોગ કર્યો, પછી કાબરે (Common Myna) ઉપયોગ કર્યો, ત્યાર બાદ બલ્બરી(Brahminy Myna) એ ઉપયોગ કર્યો અને એ જ બખોલનો ત્યાર બાદ ધોએ ઉપયોગ કર્યો! જરૂરી છે એક જૂનું ઝડ ! આજે જૂનાં ઝડ જ ઓછા થયાં છે અને નવાં એટલાં ઊગતાં નથી.

+ ૧૮-૧૧-૨૦૦૧ના રોજ, સૌ પ્રથમ ધર્મજ ગામની સીમામાં બે વૈયાં (Rosy Pastor) જોયાં. ચાર-પાંચ દિવસ જૈયાં, પછી કદાચ આગળ વહી ગયાં હશે, એટલે જોવા મજબતાં નથી. અમદાવાદના આકાશમાં વૈયાંનાં ટોળે-ટોળાં તા. ૨૫-૧૧-૨૦૦૧ના રોજ ગીતામંદિર 'બસ-સ્ટેન્ડ' નજીકનાં વૃક્ષોમાં જોવા મળ્યાં.

+ ધર્મજ વીરસદની સીમામાં એક શેત વનલેલું (Albino Jungle Babbler) જોવા મળે છે. એક જ રથને આસપાસમાં ફરતું રહેંછે. તેનો ફોટો મોકલું છું. આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું કે, તે નાનું બચ્ચું હતું ત્યારે બીજાં લેલાં તેને મારતાં. મારા નિરીક્ષણમાં તો તે લલેદું આગળ-આગળ જતું અને પાછળ બીજાં લેલેડાં ખોરાક માટે ફરતાં જોયાં.

યજેશ ભડ

આગામ ચોક, ધર્મજ-૩૮૮૪૩૦

નાના બગલાનો ટિટોડીના બચ્ચા પર હુમલો

તા. ૩-૬-૦૨ના સવારે જામનગર કિકેટ ગ્રાઉન્ડ ખાતે મારી કિકેટ પ્રેક્ટિશ માટે સવારે પોણા સાત વાગ્યે ગયેલો. ત્યાં એક બાજુમાં મોટી ગટરનું નાણું આવેલ છે. ત્યાં માટીના ટગ પર ટિટોડી (Redwattled Lapwing)ના માળામાંથી હજુ બે હિવસથી જ, બે બચ્ચાં તેમનાં મા-બાપ જોડે ચાલવા શરીર્યા હતાં. મને થોડે દૂરથી જોયા બાદ, દૂર તેના મા-બાપ સલામતી માટે તેમની પાછળ આવવા જાણે શિખવાડતાં હતાં. મા, ત્રણ ચાર પગલાં ચાલી નીચે બેસી જાય, ફરી ચાલે, ને તેની પાછળ બે બચ્ચાં. બાજુમાં બીજી ટિટોડીની હદ હતી, એટલે તેઓ પંજ આમને ભગડવા હવામાંથી નીચે 'ડાઈવ' મારી, મારો કરતાં હતા. ત્યાં એક નાનો ધોળો બગલો (Little Egret) તેમનાથી ૧૫ ફૂટ દૂર ઊતર્યો અને દૂરથી તેમને જોવા લાગ્યો. પાંચ મિનિટ પછી અચાનક દોરીને હુમલો કરી, પેલી ટિટોડીનાં બે બચ્ચામાંથી એકને પોતાની ચાંચમાં ઉપાડીને ઊગવા લાગ્યો. ત્યાં મા-બાપમાંથી એક ટિટોડી બચ્ચાને બચ્ચાવવા તેની પૂછીયે ચોટીને સાથે ઊગી. એક કાગડો, આ જ બચ્ચા માટે બગલા પાછળ પડ્યો, પણ ત્રણ-ચાર ટિટોડીએ પાછળ પડીને તેને ભગડયો. પેલી ટિટોડીએ છેક પચાસેક ફૂટ ઉપર બગલા પર હુમલો ચાલુ રાખ્યો. બગલાની ચાંચમાંથી બચ્ચું છટકયું અને નાળાની આસપાસનાં સવા ફૂટ ઊંચા ઘાસમાં ક્રાંક પડ્યું. બગલો ભાગી ગયો. ગટરની સામી બાજુનાં ઘાસમાં ક્રાંક પડ્યું, તેનો ખ્યાલ ન આવ્યો. હું દોડ્યો પણ સામે પાર જવાય તેમ ન હતું. નાનો ધોળો બગલો, દેડકાં, કાચિંડા ઉપરાંત, આવાં નાનાં બચ્ચાને પણ પોતાનો ખોરાક બનાવતા હશે? બે દુશ્મનોના હુમલાને ખાળવા આમ, દરરોજે એકબીજાની હદ માટે જઘડતી ટિટોડીની બે જોડીઓ અચાનક એક થઈ ગઈ!



ખીજડિયાની મુલાકાત

તા. ૧૫-૮-૦૨ના વહેલી સવારે હું, જુમાભાઈ, ફોટોગ્રાફર્સ પશોધન ભાટ્યા અને મનિષ ત્રિવેદી, ૬-૩૦ વાગ્યે, ખીજડિયા જવા રવાના થયા. સાત વાગ્યે ખીજડિયા પહોંચી ગયા. ત્યાં શેતપાંખ જલમાંજર (Pheasant-tailed

Jacana) નો અવાજ સંભળાયો એટલે અમે બાવળની આડશમાં છુપાયા. ૨ કલાક સુધી સફેદ કમળનાં પાંડાની જબરદસ્ત જાજમ પર આશરે ૭ જોડી ખૂબ જ નજીકથી જોઈ. ત્યાં સામે જ તેમના માળા હતા. દરેકમાં ઘેરા ભૂરા રંગનું એક ઈંદું હતું. તેના પર બેસી, થોડી વાર પછી ઉત્તીને દૂર જાય. તેમની પાછળ જ નકટા (Comb Duck) ની ચાર જોડી કાર્યરત હતી અને તે જ સ્થાન પર બે નીલા જલમુરધા (Purple Moorhen) ફર્યા કરતા હતા. આગળ જતા, બાવળનાં મોટાં વૃક્ષો પર ઢોર બગલા (Cattle Egret), પોતાના પ્રજનન પોષાકમાં, માળાઓમાં આજુભાજુવાળા સાથે પીછાં ફુલાવી ઝડપતા જોયા. બાજુમાં જ ધોળી કંકણસાર (White Ibis), તથા કાજિયા (Cormorant) ના માળાનો સમૂહ હતો. તે વૃક્ષોની પાછલી બાજુ, નાની કંકણસાર (Glossy Ibis), સાંદીકડા લઈ જતા જોઈ. ત્યાં તેનો હશે. (નાની કંકણસારનું પ્રજનન ગુજરાત રાજ્યમાં ભાગે જ જોવા મળે છે. તમે આ બાબત વધારે તપાસ કરો અને ક્યાં, કેટલા માળા તથા તેમની પરિસ્થિત વગરે વિશે વધારે માહિતી મેળવીને 'વિહંગ'ને મોકલો. - લા.) બાજુનાં પિલુડીનાં વૃક્ષોની આસપાસ રણ બુલબુલ (Whitecheecked Bulbul) પોતાના અવાજથી આકર્ષિત ખૂબ જ નજીક આવી દ્રષ્ટિમાન થતું હતું.

પહેલા સારા વરસાદથી મોટું તળાવું બન્યું છે ને સરસ આવાસ છે. ત્યાં અચાનક સુંદર દશ્ય જોયું. મોટી ચોટીલી દૂબડીને (Greatcreasted Grebe) છટાથી તરતી જોઈ. આ વર્ષે મેં તેની ત્રણ જોડી જોઈ. તેમનાથી દૂર ભગતડાં તરતાં હતાં. કબૂત બગલો (Grey Heron), કાબરો કલકલિયો (Pied Kingfisher), અને ફૂટકીઓ કાર્યરત હતા. ત્યાંથી ખીજિયા - ૧ના છેલ્લા વોચટાવર ગયા. ત્યાં ઉપર ચઢીને પીળીચાંચ ઢોક (Painted Stork), નાની દૂબડી (Little Grebe), નાની સિસોટી બતક (Lesser whistling Teal), હંજ (Flamingo), દરિયાઈ બગલો (Reef Heron), કાશિયી વાબગલી (Whiskered Tern) ને માણ્યાં. દૂર બગલાઓની માળાવસાહિત હતી. ત્યાં ઢોક (Stork), કાજિયા (Cormorant), બગલા (Egret), નાં અસંખ્ય માળા જોવા મળ્યા. વળતાં, નાની ખલિલી (Whimbrel), અને રસ્તાની બાજુએ ટપૂસિયાનાં (Whitethroated Munia) નાનાં જૂથ તથા તેતરને રસ્તો ઉત્તરી જતાં જોયા.

ત્યાંથી ખીજિયા-૨, જબુડા તરફ ગયા. ત્યાં નિરીક્ષણ મંચ પહોંચ્યા પહેલાં ભૌય ચકલી (Blackbellied Finch Lark) અને મોટો ચંડૂલ (Crested Lark) વારેઘડીયે સામા આવીને દૂર ચાલ્યા જતા હતા. ત્યાં અબલખ (Oystercatcher) ના અવાજ સંભળાયા. ગજપાઉ (Blackwinged Stilt) અને ઊલટીચાંચ (Avocet) પાણીમાં ઊભેલાં જોયા. કાળાપગ કીચિયિયા (Little Stint) ખૂબ જ કાર્યરત હતા. ત્યાં ગાડી ઊભી રાખી, ચાલીને એક સ્થળે ગયા તો મેં મારા જીવનમાં પહેલી જ વાર અદ્ભુત દશ્ય જોયું. લગભગ ૧૫૦ જળાઈ (Indian Skimmer)નું ટેળું જોવા મળ્યું. તેમની સાથે લગભગ હ જેટલી મોટી વાબગલી (Caspian Tern) સુંદર લાગતી હતી. થોડે દૂર બેસી દૂરબીનથી જળાઈની પ્રવૃત્તિ ખૂબ માણી. 'ફોટોઓરાફર્સ' ઊભડક બેસી, ધીમે ધીમે તેમની નજીક જઈ ફોટા પાડવા ગયા. હું તથા જુમાલ્બાઈ દૂરના પાણા પર ચક્કર મારવા ગયા. મોટો ચંડૂલ (Crested Lark) તો સાથે જ કંપની આપતો હતો. ફોંગલીઓ (Sand Plovers) અને મોટા ચકવાને (Great Stone Plover) જોયા.

ખિજડીયા-૧ ના છેલ્લા વોચટાવર પર ભમરીનાં દરો છે. ત્યાં ધ્યાન રાખવા જેવું છે ! ધંજાને તે કરતેલી છે! આ વખતે મને અચાનક આંખની પાંપજા પાસે ઊંઘ મારી ગઈ અને ૧ કલાક સુધી ખૂબ જ બળતરા થઈ.

અધ્યાત્મિક જ્ઞાત્ર
'શ્રી અંબાભવન', ચેટલે સોલોની, જીમનગર



White - throated Munia

White-throated Munia which commonly nests in sparse scrub forest was seen nesting on a Citrus limon (Family - Rutaceae, Local Name - LIMBU) tree, in Gujarat State Fertilizers & Chemicals Limited (GSFC) township, Fertilizer Nagar, in the backyard of our quarters no. 731 / D, where I have been staying for the past 10 months. The tree was about 2.50m. tall and the nest was at a height of 2m. The nest was constructed on a fork of a secondary and tertiary branch of the tree well inside the canopy. The nest opening was facing the east direction, which had 100 % canopy cover above and 60 % canopy cover around the

nest. The visibility was 20 % from the east, 10 % from the west, 95 % from the north and 90 % from the south. The selection of a nest site on a thorny tree species is to avoid the attack from terrestrial predators like mongoose, domestic cats and so on, while the cover above the nest acts as an escape cover from aerial predators.

The nest was dome shaped, mainly comprising of grass (Eragrostis Sp., Family Poaceae, Local Name - Charchariyu), which forms the outer side of the nest. This was interspersed with threads, twigs, feathers and dry faecal matter on the outer wall of the nest. Dry cotton was used to line the inner walls of the nest with more cotton padding at the bottom and floor of the nest. This would ensure a soft substrate to the chicks in addition to the warmth it would provide.

Two birds probably a male and a female (could not be identified, as they look alike) were seen visiting the nest everyday. Since the birds were always around the nest, it was not possible to ascertain whether there were hatchlings inside. The birds were seen around the nest for about 15 days. It is very evident that this species has developed a survival strategy for itself and its chicks by selecting thorny species for its breeding.

I am very much grateful to Mr. Pankaj Joshi (Research Biologist) for identifying the grass species and Dr. Justus Joshua (Scientist - Ornithology & Wildlife Biology) for going through the manuscript and suggesting relevant changes and providing encouragement.



Birds seen in & around Gomati Pond, Dakor

During my visit to Dakor town, which is 36 kms away from Anand, on 22nd December 2001, I listed following birds in & around Gomati pond area.

Birds in Gomati pond :

Little Cormorant - 12, Pond Heron - 5, Wood Sandpiper - 8, Purple Moorhen - 4, Whitebreasted Waterhen - 4, Little Grebe - 18, Little Egret - 3, Median Egret - 2, Pheasant - tailed Jacana - 2, Black Ibis - 5, Common Sandpiper - 4, Marsh Sandpiper - 2, Redshank - 2, Greenshank - 2,

Bird Species	Status / Remarks
Yellow - cheeked Tit	Frequent
Alpine Swift	Sighted once
Dusky Crag Martin	-do-
Crested Buntnig	Frequent
The Cuckoo	Common on hill-tops, breeding ?
Brown Rock-Chat	Common, breeding
Yellow-Eyed Babbler	In Lantana hedges, breeding ?
Kashmir Roller	Return Passage
Piedcrested Cuckoo	Return Migration
Spotted Munia	-
Rufous-bellied Babbler	-
Indian Scimitar Babbler	Only call heard
Green Munia	Riverine area-grass mosaic, interior forest
Grey Junglefowl	Not uncommon, heard regularly
Whitenecked Stork	Seen at a pond, one sighting

Blackwinged Stilt - 11, Redwattled Lapwing - 23.)

Birds flying over the area :

Wiretailed Swallow - 8, Red rumped Swallow - 5, Whitebreasted Kingfisher - 1

Hiren Soni

Gujarat Institute of Desert Ecology (GUIDE)



Bird - watching at Mt. Abu. Some Interesting Observations

From 6th to 9th September, 2002, I had the opportunity to watch birds of Mt. Abu thanks to a beautiful camp - site and varied nature trails in the interior forest areas. Mt. Abu has sub-tropical forests with evergreen trees of Jamun and preponderance of wild mangoes. It is an important area for studying bird distribution in the country. The following birds (considered as important and

interesting sightings) were recorded during casual bird - watching.

The check - list made over three and a half days was over sixty birds. The areas covered were Guru Shikar, Achalgadh, Orya village precincts and nearby forest areas. The existing threats to avifauna are, (i) invasion by the exotic shrub - Lantana, (ii) damage to the natural forest by excessive grazing and (iii) unregulated tourism and its side effects. Although parts of Mt. Abu fall under the Mt. Abu Wildlife Sanctuary, many areas outside the Sanctuary are better than those within.

However, the good signs that are visible include, (i) agriculture without or with a low use of pesticides and fertilizers. (ii) relatively good state of some interior forest patches and (iii) priority given to pasture development by the farmers. Proper documentation of avifauna is missing and needs attention. In this regard, monitoring of its avifauna by bird-watchers would be useful. (ગુજરાત બાહ્યરનો પડ્શ સરહદ વિસ્તાર હોવાથી આ નોંધનો સમાવેશ કર્યો છે. - સં.)

Pranav Trivedi
18, Sukomal Flats, Ramdev Nagar, Ahmedabad



ગોધ પર જાપતો

* તા. ૨-૧૨-૦૨ના રોજ હું અને મારા ભિન્ન શ્રી ડી.જે. રાજપૂત (માંડવી ઉત્તર) બારા વિભાગના ઝંગલ વિસ્તાર ઉચ્છ્વલ મુકામે ગયા. ત્યાંથી ૧૦ કિ.મી. ત્રવાણ મુકામે જતાં, ગીધના ત્રણ માળા જોયા. દરેક માળા સાથે બે-બે ગીધ જોવા મળ્યાં. સાંજનો સમય હતો. અંધારું થવા આવ્યું હતું. બચ્ચાં જોઈ શક્યા ન હતાં. એક માળો પીપળના જાડ પર, બીજો સાદળના જાડ પર અને ત્રીજો દૂર હુંગર પર હતો, જાડ ઓળખી શકાયું ન હતું. આજુબાજુના આદિવાસી રહીશોને પૂછતાં જણાવ્યું કે, ઊંડાણના ભાગે હજુ પણ માળા છે.

જ્યંત એસ. ભોજ્વાલા
અન્નીવાડ, ધોરીમાર્ગ, માંડવી, જિ.સુરત.

* તા. ૮-૮-૦૨ના રોજ સવારે, ૮-૩૦ થી ૧૨-૦૦ વાગ્યાની વચ્ચે, શીલજ તળાવના કંઠે ચમારે રાને ગાયનું ચામડું ઉતાર્યું હતું. રાગ પટેલ જોડે વાત થયા મુજબ, ૭-૮-૦૨ના રોજ પણ કોઈ ચમારે ગાયનું ચામડું ઉતાર્યું હતું. શીલજ તળાવની આગળ ત્યારે મરેલી ગાય ઉપર રાગે જીભનિ ઉપર બેઠેલાં રૂડ ગીધ નોંધા હતાં. બીજે દિવસે ત્યાં અમોને ગીધનું એક ટોળું આકાશમાં ચક્કર મારતું દેખાયું. અમે શીલજ તળાવ પાસે બાવળની વચ્ચે મોટરબાઇક લઈને ઘુસ્યા. મરેલી ગાય પડેલી હતી. ૨૫૦ જેટલા કાગડા, ૪ કૂતરાં અને ૧૫૦ સમયી, ગાય પર હતાં, પરંતુ ગીધ નીચે ઉત્તરતાં બીતાં હતાં. જાડ ઉપર ૮ ગીધ,

કૂતરાં ખસવાની રાહ જોતાં હતાં. બાવળના વૃક્ષની વચ્ચે મૃતશરીર હોવાથી તેઓ સીધા નીચે ઉતરી શકતાં ન હતાં. લગભગ ૨-૩૦ કલાક પછી કૂતરાઓને ભગાડતાં ગીધ નીચે ઉત્તરવા પ્રયત્ન કર્યો અને ત ગીધ ગાયને ખાવા માંડાં. ત્યારે અમે ફોટો પણ પાડ્યાં. પરંતુ, કૂતરાં એટલા ભૂખ્યા હતાં કે તેઓ ગમે તેમ કરીને ગાય પાસે આવી જ જતાં હતાં. પાસેનાં બીજાં વૃક્ષ ઉપર લગભગ ૨૨ જેટલાં ગીધ ખાવાનાની રાહ જોઈ બેઠા હતાં, પરંતુ તેમને ખોરાક મળ્યો ન હતો.

ગીધ માટે આ ખૂબ જ મોટો પ્રશ્ન અમોને જોવા મળ્યો.
* એલ.ડી. કોલેજમાં દેખાતા લગભગ ૪૦ જેટલાં ગીધ સપેખ્યર માસમાં દેખાતાં બંધ થઈ ગયેલ છે. આ સાલ સપેખ્યરમાં, લો ગાર્ડન, ગુલબાઈ ટેકરા, આઈ.આઈ. એમ., ગુજરાત કોલેજ, અન.આઈ.ડી., જાંસીની રાષ્ટ્રીના પૂતળા પાસે, એલ.ડી. કોલેજ, એચ.એલ.કોલેજ બધી જ જગ્યાએ ગીધ દેખાતાં બંધ થયા છે. આ બધી જગ્યાએ છેલ્લાં ત્રણ વર્ષથી ગીધ અને તેમના માળા મેં નોંધા છે. આ બધાં ગીધ કર્યાં ગયા હશે?

કાર્તિક શાસ્ત્રી

અશોકવાડી, પંચવટી, અમદાવાદ-૩૮૦૦૦૬



* ઘણા વખત પછી મહુવા (જિ.ભાવનગર) માં તા. ૧૦-૮-૦૨ના રોજ બપોરના સમયે, ૨૫ સફેદપીઠ ગીધ



ગીધ પર જાપતો

ઉડતાં જોવા મળ્યાં. અગાઉ એક સાથે ૪૬ સંકેદપીઠ ગીધ એમાંથી પાંચ ખેરા (Scavenger Vulture) હતાં. જોવા મળેલ (જેની નોંધ વિહંગને મોકલેલ), પરંતુ પછી પથી ૧૦ જેટલાં જ ગીધ નિયમિત જોવા મળતાં. ત્યાર બાદ, લાંબા સમયે આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યાં, તો શું આટલો સમય તે અન્ય સ્થળે રહ્યા હશે? તા. ૧૦-૮-૦૨ના રોજ સાંજે ૪-૩૦ કલાકે હું તથા શ્રી જ્યદેવભાઈ ધાધલ મહુવાની નજીક કોલેજના મિશ્રોને પક્ષીદર્શન કરાવતા હતા ત્યારે ફક્ત ૧૦૦ મીટર જેટલી ત્રિજ્યામાં ૧૭ જેટલી વગડાઉ ટિટોડી (Yellow wattled Lapwing) એક સાથે જોઈ. આ પછેલાં એક સાથે આટલી મોટી સંખ્યામાં વગડાઉ ટિટોડી જોવા મળેલ નહીં.

પ્રા. પ્રવીક્ષ ડોડિયા

પર, શાસ્ત્રીનગર સોસાયરી, મહુવા, ગ્ર. ભાવનગર.

* તા. ૧૦-૨-૦૨ના રોજ સગાઈ 'કેમ્પસાઈટ' પાસે આવેલી નદી કિનારે એક ગિરનારી ગીધ (Longbilled Vulture) બેઠેલું જોયું.

* તા. ૨૩-૫-૦૨ના રોજ રાજકોટ જવાનું થયું હતું. વટામણ ચોકડીથી બગોદરા જવાના માર્ગ પર એક લેંસ મરી ગઈ હતી. રસ્તાની બાજુમાં આવેલાં વૃક્ષો પર જ ગીધ જોયા. સમય : ૧૧ - ૫૦ વાગ્યે - સવારે.

* તા. ૨૩-૫-૦૨ના રોજ રાજકોટ જતા ધોરીમાર્ગને અડીને આવેલા સાયલા ગામના પાદરમાં ૨૧ ગીધ જોયા.

* તા. ૨૫-૭-૦૨ના રોજ બોડેલી ગયો હતો ત્યારે ડભોઈથી આગળ જતા, આકાશમાં ૧૧ ગીધ જોયા.

અનિત ગોઢિલ

એ-૫૭, ભાગ્યલક્ષ્મી સોસા., આઈ.ટી.આઈની બાજુમાં, બરોડા-૧૬

* છેલ્લા ચાર મહિનાથી પેટલાદથી બોધણી જવાના રસ્તા ઉપર રંગાઈપૂરા ગામ પાસે તાડનાં વૃક્ષ ઉપર પાંચથી છ ગીધ જોવા મળ્યાં છે. હમણાં તેની ઉપર માળો પણ છે. ગીધને ઊચા વૃક્ષ જોઈએ. અગાઉ પણ મેનોંધ મોકલી હતી, ખંભાત પાસેના તાડનાં વૃક્ષ ઉપર ખૂબ જ માળા થાય છે, તેવી જ રીતે અહીંયા બે જ વૃક્ષ છે પણ માળા માટે તેનો ઉપયોગ કરવો ગીધને ખૂબ માફક આવે છે તે જોઈ શકાય છે.

પણેશ ભક્ત

અભિનાદ ચોક, ધર્મજ- ૩૮૮૪૩૦

+ તા. ૧૭-૬-૦૨ના રોજ વટામણાથી ભાવનગર આવતી વખતે વટામણા ચોકડીથી પીપળી વચ્ચે આવેલા વારણા નામના ગામ પાસે, સવારે ૧૧ વાગે, ૧૫ સંકેદપીઠ ગીધ (Whitebacked Vulture) અને ૮ સમઠી (Pariah kite) એક મરેલા ઢોર પાસે જોયા હતાં.

ઇન્દ્ર ગઢવી

ખોટ - ૨૨૦૦, અંકુર સોસા., ભાવનગર - ૩૬૪૦૦૧

સારકા વોચ

◆ દર વર્ષની જેમ, ઉનાળું રજાઓ દરમિયાન, તા. ૧૮-૫-૦૨ના રોજ, મય્યુ-૨ બંધ પર સારસ જોવા ગયા. બંધમાં પાણી વધું હતું. વચ્ચે રચાયેલ બેટ પર ર ૨ની સંખ્યામાં સારસ હતાં, જે મય્યુ-૨ પર જોયેલ સૌથી વધું છે. જળાશયમાં અન્ય ૨ મોટી ચોटીલી દૂબડી (Greatcrested Grebe) અને થોડા નાના-કાળિયા (Little Cormorant) સિવાય અન્ય પક્ષીઓ ન હતાં.

અશોક મથરુ

એ-૭, આલાપ ડેરીટેજ, સત્ય સાર્થ હોસ્પિટલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ

◆ તા. ૩૧-૫-૨૦૦૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે ખેડા પાસે ટોલ-ટેક્સ નાકાની નજીકના ખેતરમાં ચાર સારસ જોયા.

અનિકા એસ. જ્યદ્વ

ગુજ. એગ્રીક્લ્યુર યુનિ., બાયો કાર્બોલ. લેબ. આંકંડ ૩૮૮૧૧૦.

◆ તા. ૬-૭-૦૨ના રોજ ઈલી જળાશયમો ૨ સારસ જોયા.

◆ તા. ૩-૮-૦૨ના રોજ આણંદ - નડિયાદ ધોરીમાર્ગ



પર ૧ સારસ જોવું.

અનિલ ગોહિલ

એ-૫૭, ભાગ્યલક્ષી સોસા., આઈ.ડી.આઈની બાજુમાં, બરોડા-૧૬.

❖ તા. ૧૮-૭-૨૦૦૨ના રોજ રાત ગામના તળાવ પાસે બે સારસ જોવા મળ્યાં. રાસની આસપાસમાં છ થી આઠ સારસ જોવા મળે જ છે. વધારો થયો હોય તેવું દેખાતું નથી. ધર્મજથી વીરસદના રસ્તા પાસે અંદર બેતરમાં તલાવારી છે, જ્યાં સારસે માળો બાંધ્યો હતો. એક હીંદું હતું. જેમાંથી બચ્ચું થયું હતું, પરંતુ થોડા સમય પછી બચ્ચું જોવા મળ્યું નથી. બે સારસ ત્યાં જ રહે છે. એક વખત નહેરનું પાણી છોડ્યું એમાં માળો નાચ થયો હોય તેમ લાગ્યું, પરંતુ ફરી એ જ જોડિએ માળો બનાવ્યો અને બચ્ચું થયું હતું. સારસની સંખ્યા આમ પણ વધતી નથી અને કોઈક જગ્યાએ માળો થાય તો બચ્ચું જીવે તેની શક્યતા નહીંવત્ત હોય છે, તો આ બાબતે કંઈક નક્કર પગલાં લઈ બચ્ચાં ઉછેરી ના

શક્ય ? સારસ માટેનો કોઈક ખાસ કાર્યક્રમ હાથ નહીં ધરીએ તો આવતાં વર્ષોમાં સારસ જોવાં દુર્લભ થઈ જશે. આ વર્ષે પરિભેજ અને આસપાસમાં ચોમાસાની ઋતુમાં ભાગ્યે જ સારસ જોવાં મળ્યાં, જ્યાં નહીં તો ખૂબ સારસ જોવા મળતાં હોય છે.

યજોશ ભક્ત

આગાદ ચોક, ધર્મજ-૩૮૮૪૩૦

❖ તા. ૨૧-૭-૨૦૨ના રોજ બપોર પછી અમદાવાદથી ભાવનગર આવતી વખતે બાવળા પાસે ધોરીમાર્ગથી લગભગ ૧૦૦-૧૫૦ મી.ના અંતરે ૧૦ સારસ જોવાં.

ઇન્ડ ગઢવી

લોટ-૨૨૦૦, અંકુર સોસા., ભાવનગર-૩૬૪૦૦૧

પત્ર-સોતુ

ક પક્ષીનિરીક્ષણ શિબિર, પોરબંદર

આ વર્ષના શિયાળામાં, તા. ૨૬-૧ તથા ૨૭-૧-૨૦૦૨ના રોજ, મૃકૃતિજીતન પરિવાર- ભાણવડ તથા ભાયાવદર નેચેર કલબ- ભાયાવદર દ્વારા પોરબંદર આસપાસના વિસ્તારમાં ખાસ પક્ષીનિરીક્ષણ માટે જ શિબિરનું આયોજન કરી પક્ષીમિત્રોને નિમંત્રણ આપાયું. નવા વિસ્તારોમાં પક્ષીઓ નિહાળવાનું ફૂટુહલ તથા તે વિસ્તારની વિશેષતા પામવા ઈચ્છાક, હું પણ પહોંચી ગયો.

આ શિબિરમાં કુલ ૨૭ પક્ષીનિરીક્ષક મિત્રો અલગ-અલગ જગ્યાએથી આવી એકનિત થયા. કાર્યક્રમ તા. ૨૬મીની બપોર બાદ, છાયાનાં રણ (ખાડી)થી શરૂ થયો. ગ્રાનેક હજાર જેટલાં નાના હંજ (Lesser Flamingo)ની ગુલાબી રંગની આભાથી વાતાવરણ છવાપેલું તથા તેના “હોંક હોંક” અવાજોથી છુંબત હતું. થોડે દૂર જ શિયાળું એની ડૂબડીઓ (Blacknecked Grebe) ઝડપથી તરી ડૂબકી મારતી હતી. અન્ય મુખ્ય પક્ષીઓમાં ઊલટીચાંચ

(Avocet), શેતપીઠ

કીચડિયો (Curlew Sandpiper), કાળપેટ કીચડિયો

(Dunlin), તુતવારીઓ (Sandpiper) વગેરે જોવા મળ્યાં.

શ્રી ભરતભાઈ રઘુણીએ જણાયું કે, આ જગ્યાએ હંજ (Flamingo) માટી વડે દર વર્ષ માળા બનાવે છે, પરંતુ હંજ મૂકતાં નથી. તેને ‘Playnest’ કહે છે. ત્યાંથી સર્વ, શહેર વચ્ચે આવેલ પક્ષીઅભયારણ જોવા ગયા. પહેલાં મોટી સંખ્યામાં હંજ, બતકો, ધોમડા (Gulls), વાંગળી (Terns) રહેતાં, પરંતુ જળાશયમાં વચ્ચે બાંધકામ થતાં પાણીની ઊડાઈ વધી ગઈ. પક્ષીઓ ઓછાં થઈ ગયાં. તેમ છતાં વિવિધ બતકો અને કીચડિયા (Stints & Sandpipers) જોવા. શહેરમાં અન્ય એક જગ્યાએ હંજ પામેલ પેણ જોવા ગયા. ખાડીમાં પેણની પાંખમાં મદ્ધીમારીની જાળની દોરી ફસાયેલ હતી. ઊડી શકૃતું ન હતું. અન્ય પક્ષી-મિત્રો તેને બચાવવા કાદવિયા પાણીમાં ઊતર્યા, પરંતુ તે ઝડપથી



તરી દૂર જતું રહ્યું. રાત્રે શ્રી ભરતભાઈ રૂધાણીએ તેમણે અત્યાર સુધી પાડેલ પક્ષીઓની સ્લાઇફ્ઝ, વિશેષ જાગ્રાતી સાથે, તૃકલાક સુધી બતાવી. તેમની સુંદર કલા જોઈ બધા મિત્રો ખુશ થયા.

બીજે દિવસે સવારે વાહનમાં સુભાષનગર ખાડી અને જાલવર જઈ પક્ષીનિરીક્ષણ શરૂ કર્યું. અહીં ક્રીચટિયા વિશેષ હતાં. ૪૦૦ જેટલી નાની ઢોંગલી (Lesser Sand Plover) આમતેમ દોડતી હતી. અન્ય પક્ષીઓમાં મોટી બાટરા (Grey Plover), મત્સ્યખોજ (Osprey), પાન પડ્છાઈ (Marsh Harrier), કાળાપગ ક્રીચટિયા વગેરે હતાં. થોડે આગળ જતાં જ વાહન પાંચું લેવડાવી ભરતભાઈએ જણાવ્યું “ચાલો તમને નાની ખલિલી (Whimbrel) અને સોનેરી બાટરા (Golden Plover)નું સ્થળ બતાવું, જરૂર મળશે.” રસ્તાની બસે બાજુ છીછરાં પાણી ભરાયેલ જગ્યાએ આ બસે તો જોયા, તદ્દુરાંત, ઓછા જોવા મળતાં નાના ગડેરા (Bartailed Godwits) અને કાળો રાતાપગ (Spotted Redshank) પણ મળી ગયા. ખલિલી પણ હતી. આગળ કુછદી જવાનાં રસ્તે ૨૦૦ની સંખ્યામાં પીળાપગ ધોમડા (Herring Gull) એકત્રિત થયેલ હતાં. સુંદર ટપકાદાર કાળા વૈપા (Starling) નું એક ટોણું તાર પર બેહું હતું. ઘરીકમાં નીચે ગાંડા બાવળ ઉપર કે જમીન પર ઉત્તરે, તો ઘરીકમાં ફરી તાર પર. આગળ જતાં ટિલોર (Houbara Bustard) નો વિસ્તાર આવ્યો. છેલ્ખાં ર વર્ષથી ત્યાં પથ્થરની ખાડો વધી જતાં જોવા મળેલ નથી. ચાલુ વાહને દૂર કરાડ પર બેઠેલી લર્જ (Kestrel) ભરતભાઈએ બતાવી.

બપોરે કુછદી પહોંચા ત્યારે વાતાવરણ કરકરા (Demoiselle Crane) ના અવાજોની ભરપૂર હતું. આશરે ૨૦,૦૦૦ કરકરા આરામ ફરમાવતા હતા. માણસથી ટેવાયેલા કરકરા ખૂબ નજીકથી જોવા મળ્યા. બોજન બાદ, બરડા-સાગર તેમ ગયાં. પાણીમાં વિયા તથા ગાંડોબાવળ પથરાયેલ હતા. ત્યાંનાં મુખ્ય પક્ષીઓમાં મોટી ચોટીલી ઝૂલકી (Greatcrested Grebe) બચ્ચાં સાથે, નીલ જલમુરધા (Purple Moorhen), ધોળિડોક ઢોંક (Whitenecked Stork), રૂપેરી પેણ (Dalmatian Pelican) હતાં. બતકોમાં, નકટા (Nukta), લુણાર (Gad-

wall), ગયણા (Shoveller), રાખોડી કારચિયા (Common Pochard), તિરજા (Cotton Teal), પિયાસણ (Wigeon), નાની મુરધાણી (Common Teal) જણાશયમાં વિહરતી હતી. ટેલિસ્કોપથી દૂર, ૧૫૦ ગુલાબીપેણ (Rosy Pelican) તથા ૧૦૦ જેટલી નાની કાંકણસાર (Glossy Ibis) ઝડપાઈ ગઈ. અંતે મેઢા કીક તેમ ગયા. પાણી વંદુ હતું. ખાસ પક્ષીઓન હતાં, પરંતુ તેમ પર પ્રથમ વાર લડાખી વાબગલી (Common Tern) તેનાં પ્રજનન પહેરવેશમાં જોઈ.

આયોજકો શ્રી ભરતભાઈ રૂધાણી, જ્યદેવસિહ ધાખલ અને જિરીશભાઈ દ્વારે એક સરસ અનુભવ પ્રદાન કરવા માટે તથા જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવા બદલ અભિનંદન! અગત રીતે જતાં પક્ષીનિરીક્ષણ આ રીતે ફળદાયી ના નીવડે. નવા વિસ્તારોમાં આવી શિબિરનું આયોજન સ્થાનિક પક્ષીનિરીક્ષકો કરે તો, ત્યાંનાં નિવાસી પક્ષીઓ જોવા જાણવા તો અચૂક મળે, તેમજ અરસ-પરસ વિચારો-જ્ઞાનનો લાભ સૌ પક્ષીનિરીક્ષકો મેળવી શકે.

અશોક મશરૂ

અ-૭, આલાપ ડેરીટેચ, સત્યસાહી લોસ્પ્ટલ પસે, કાલાવડ રોડ, રાજકોટ

પક્ષીસંરક્ષણ મંડળ, ગુજરાતને આવકાર

‘વિહંગ’ માસિક નિયમિત મને મોકલાય છે, તે બદલ આપનો આભાર માનું છું. અદ્ય પક્ષીઓને સમાચાર દ્વારા પ્રત્યક્ષ જોતાં હોઈએ તેવી લાગણી વાચનની થતાં, આનંદ આવે છે. કુદરતનું સાંનિધ્ય રાખવાની પ્રવૃત્તિના ભાગ રૂપે પક્ષીઅભ્યાસ (૩.૧. ૧૫-૧૬થી શરૂ કર્યો હતો. તેનાથી મન મજબૂત બને છે અને આત્માનંદ મેળવાય છે. ૧૯૭૭માં નોકરીમાંથી નિવૃત્તિ લઈ સાંશંદ મારા પુત્ર ડૉ. જનાર્દન ભડે પોતાની ‘પ્રેક્ટીસ’ શરૂ કરેલ, જેથી સાથે રહેવા આવ્યો. થોડા સમય પછી, ડાકોરસાડેબ સ્વ. જ્યવંતસિહજના દરબારગઢની નોકરીમાં જોડાયો. મુખ્ય હેતુ, તેઓશ્રી શાસ્ત્રીય સંગીતના પ્રભર અભ્યાસી હતા અને બહારના ગાયકો અંવારનવાર ત્યાં આવી ગાયન કરી જતાં, એટલે શાસ્ત્રીય સંગીત સાંભળવાની મારી જંખના પૂરી થાય. આ નોકરી પગારલક્ષી ન રાખતાં નિજાનંદ ગ્રામ કરાવતી

હોઈ સ્વીકારેલી, જે ચાલુ છે. હવે ૮૨મું વર્ષ ચાલે છે. એટલે ત્યાંથી નિવૃત્ત થનાર છું. મારા આજ સુધીના જીવનકાળ દરમિયાન સ્કાઉટીંગ, રસોઈવિજ્ઞાન, નાટકો, વિગેરેમાં સારો કહેવાય, તેવો અનુભવ મેળવ્યો છે. ૧૯૩૭ /૩૮થી ભાવનગરમાં 'યેગ કલબ'નાં નાટકોમાં અગ્ર ભાગ લીધો હતો. તેમાંય, 'દાદાજ'નું અમારું એકાંકી નાટક, પ્રેક્શનોની પ્રશંસા પામતું.

પક્ષીઓના નિરીક્ષણ અભ્યાસ માટે બહાર ફરી શરૂ તેવી મારી શારીરિક સ્થિતિ રહી નથી. જે કાંઈ સાહિત્ય હોય તે જોઈ લઉં છું. આપ પક્ષીઅભ્યાસ કરવા-કરવા વિચારી રહ્યા હો, અગર અમલમાં મૂકવાની શરૂઆત કરતા હો તેમાં મારો સહકાર હશે જ. 'વિહંગ' માં આવતાં સૂચનો સાથે હું પણ સંમત છું જ. 'ગુજરાત પક્ષીસંરક્ષણ મંડળ' સભ્ય ઝી રાખીને સ્થપાય તો પ્રવૃત્તિ નિરંતર, સ્થિર રીતે, લાંબો સમય ચાલશે. આ માટે કાયમી મુખ્ય સંસ્થાનનું સ્થળ પણ સૂચનો સ્વીકારી નક્કી કરવાનું થશે.

આ પાંગરતી સંસ્થાને પોતાનું મકાન કરવા સારી એવી રકમની જરૂર પડશે. તે માટે પ્રયત્નો થાય તો મને શર્ધ્યા છે કે, આ કાર્ય વઈ શકશે. સંભવિત બિલ્ડિંગમાં પુસ્તકલાય, કાયમી પ્રદર્શન; ચિત્રો ફોટોગ્રાફ્સ માટેના બંડો હશે, તથા પક્ષીઓને લગતી માહિતી પ્રાપ્ય થાય તેવી વ્યવસ્થા સુલભ હશે.

આ બાબતે રસ ધરાવતા અભ્યાસુઓનું એક સંમેલન પ્રથમ બોલાવાય અને તેમાં યોજના વિશેનાં - મંત્ર્યો, પ્રત્યક્ષ સહકાર- દ્વયની જરૂરિયાતની ચર્ચા કરવા મુસહો તૈયાર કરી મુદ્દાની નોંધ સંમેલન આમંત્રણ સાથે જ મોકલાય તો ચર્ચા સફળ થવાનો સંભવ વધારે રહેશે. અસ્તુ.

આપણા વિહંગની પાંખો - ગરૂડ કે આલબેટોસ જેવી બને તેવી અભિવાધા છે.

નરહરિ ઝ. ભક્ત

બ્રહ્મપોળ, સાંકંદ-૩૮૨૧૧૦

પુરાના પરિચિત મિલ ગયા !

'વિહંગ' પત્રિકા કા શરદ ૨૦૦૧ અંક દેખને કો મિલા છોટે-છોટે નેચર નોટ્સ સે ભરી યહ પત્રિકા પઢકર બીએનેચએસ કી જરૂર પઢને જિતના હી આનંદ આયા ।

હમારે અડોસ-પડોસ કે પક્ષીઓને હમ કિતને આત્મીય હો ઉઠતે હોય ઔર વે હમારે મનકી ઉદાસીકો કિસ કરદ દૂર કર સકતે હોય, ઇસકા પ્રત્યક્ષ અનુભવ મુજ્જે હાલ હી મેં હુાં, જવ મૈં બોસ્ટન મેં થા । સિતંબરકે દિન થે ઔર ચારોં ઓર અજનબી વાતાવરણ થા । સવ કુછ ઘર સે અલગ ઔર અપરિચિત લગ રહા થા । મન ઉદાસી સે ભરા થા । મૈં સુબહ પૈદલ ચલને જાતા થા ઔર આસપાસકે પશુ-પક્ષીઓનો દેખા કરતા થા । મુજ્જે વહાંકે આધીકાંશ પશુ-પક્ષી તો ના લગે, ઉનકે નામ તક મુજ્જે નહીં માલૂમ થે, પર હમારે યહાં કે કૌએ, ગૌરૈએ ઔર કવૂતર જસર મીલ ગણ એ । ઉન્હેં દેખકર લગા કી કોઈ પુરાના પરિચિત મિલ ગયા હૈ ઔર મન બહુત હલ્કા હો ઉઠા ।

લેકિન એક બાત મૈને દેખી । વહાં કે પક્ષીઓને મનુષ્ય કે પ્રતિ વહ વિશ્વાસ નહીં હૈ જો હમારે યહાં કે પક્ષીઓને મેં હોય । હમારે યહાં કૌએ, ગૌરૈએ, કવૂતર, બુલબુલ, ફાખ્તા આદિ બડી નિડરતા સે હમારે ઘરાંકે અંદર તક આ જાતે હોય ઔર આંગનમેં હમસે કુછ હી કદમ કી દૂરી પર વૈઠ કર દાના ચુગતે હોય । પર બોસ્ટનકે પક્ષી સ્થાન સુધીઓનો દુશ્મન સમજતે થે ઔર ઉનકે નિકટ આતે હી ઉડ જાતે થે ઝસ્કા કારણ મુજ્જે યહ લગતા હૈ કે વહાંકે લોગ પશુ-પક્ષીઓનો કા શિકાર બહુત ક રતે હોય । બચ્ચે - બચ્ચે એયરાન લેકર ઘૂમતે હોય ઔર પશુ-પક્ષીઓનો નિર્મમતાસે માર્ટે હોય । ઝસલિયે વહોંને પક્ષીઓને મનુષ્યોનો શત્રુઓ કી સૂચી મેં ડાલ દિયા હોય । પર જવ ઉન પક્ષીઓને મુજ્જ જૈસે શાંતિપ્રિય વ્યક્તિકે પ્રતિ ભી વૈસી હી ભયાંકાંત પ્રતિકિયા જતાઈ, તવ મુજ્જ જરૂર અફસોસ હુાં કિ, કેસે કુછ મનુષ્યોની કર્તૃતો સે સમસ્ત માનવજાતિ બદનામ હો જાતી હોય ।

વાલસુબ્રમણ્યમ્

સી-૧૦૫, પ્રીમિયર એપાર્ટમેન્ટ્સ, બોડકરેવ, અહેમદાબાદ-૩૮૦ ૦૪૮

A few Random Comments

It was so heartening to read the comments of my dear revered friend Lavkumar Khachar in the Varsha 2002 issue of 'Vihang', which gives me the inspiration to type these lines. He must have been in a great good form while writing them. It was also a matter of satisfaction for me that by and large he has touched upon issues similar to the ones that I have tried to

emphasise in my article in Gujarati, just posted to Dr. Bakul Trivedi. An impression goes round that I am a great expert on birds, and recently in a function in Bombay a real expert in his own right described 'yours sincerely' as his 'guru' ! I however know my limitations in the field of ornithology. If any one dispassionately compares Lavkumar's knowledge and experience with mine it would be very apparent that he could score over me at any time. It is true that both of us started our studies of birds at tender ages, but the advantage Lavbhai had over me was in the expert guidance and teaching of Dharmakumarsinhji, where as I am almost selftaught. Apart from all that, he (Lavkumar) has had opportunities of seeing and studying birds in all manner of biotopes as also ecosystems right from the snowlines of the Himalayas down to the sea level.

Writing about field notes and proper identification of aves, I am reminded of my own experience in the plantation of Vijay Vilas palace near Mandvi. While taking a stroll there, one day after lunch, I saw a thrush on the ground foraging for food among the fallen dry leaves. It was not at all shy and allowed close approach, allowing me to note the colour pattern of its plumage. I did not have my notebook with me nor binoculars, but I thought I had made sufficient mental notes to enable me to identify the bird concerned. However I failed to do so. That is why in my above mentioned Gujarati article I have advised keeping a note-book and pencil besides a pair of binoculars. If one fails to note down the salient features of new birds seen, then later on, coming back home, one's memory can play ducks and drakes with ones attempts of identifications ! That is why I never advocate rushing in to print on seeing a new species, and this fact is corroborated by Lavkumar in the case of the Green Cochoa seen by him. This self - imposed restriction is the essence of the science of ornithology.

The old established practice or rule was to collect specimens of any new bird that was seen. The very idea of taking a life even for the sake of science is abhorant and yet, how-so-ever reluctantly, I collected the Haircrested Drongo and the Greyheaded Flycatcher to establish my

credentials as a reliable birdwatcher ! It is better to shoot them with a camera and that is why it has been my practice now to strongly advise the taking of photos of new birds seen.

I may mention here that I am a staunch adherent to what I call ' the Salim Ali doctorines' (except ofcourse collecting specimens) and having mentioned self-imposed restriction and so on, it would be appropriate to give examples of the attitude of that great ornithologist in given circumstances. While on visits to the Great Rann of Kutch to study the Flamingos Dr. Salim Ali came across Little Gulls (*Larus minutus*), but how cautious he was in confirming their identity could best be described in his own words from the Journal of Bombay Natural History Society (Vol. 71 No. 3, pp. 609 - 10) ! The heading of his note is ? The Little Gull, *LARUS MINUTUS PALLAS* in Kutch (' note the question mark !) . In the note he says : 'On visits of the Great Rann of Kutch in April 1956, April 1957, March 1960 and again as recently as January 1974, I observed rather distant flocks of a puzzling Gull which struck me at the time could, by all rules of the game, be no other than the Little Gull, *Larus minutus*, Pallas. I did not publish this earlier in view of the extreme paucity of records and lack of conviction on my own part. However on the latest visit to the Rann (23/24 January 1974), I was able to watch a fairly large flock sufficiently closely to support my earlier conjecture, though confirmation must still await a specimen. If an expert of international fame, that Dr. Ali was, did not rush to a conclusion inspite of the fact that he had correctly identified the Gull concerned would it be proper for lesser mortals to hastily add birds to our lists ?

And finally, while I am on the subject of identification of birds, I would earnestly suggest that Lavbhai should publish some hints on the recognition of birds in a serial form for the benefit of the readers of 'Vihang' and if at a later stage these are published in book form, I have no doubt it would prove to be his valuable gift for posterity.

M.K. Himmatsinhji
Julilee Ground, Bhuj
